

ਪ੍ਰਦਾਨ - ਹਰਿਝੰਨ ਸ਼ਾਹ

ਏ ਏਂਦੂ

ਆ ਨਾਨਕਡੀ ਚੋਧਤੀਮਾਂ ਵਣ੍ਣੇਲਾ ਤਥਾ ਐਵਾ
 • ਅਕਾਰਨਾ ਪੀਲ ਹਰਿਜਨ ਸਾਂਤ-ਭਕਤੋ ਅਨੇਕ ਪ੍ਰਕਾਰਨੀ
 ਹਾਡਮਾਰੀ ਨੇ ਹੇਰਾਨਗਤਿਮਾਂ ਪਣੁ ਜਵਨਨਾ ਸਤਵਨੇ ਭੂਖਧਾ
 ਨਥੀ. ਜੇਕੇ ਤੇਓ। ਸਮਾਜਨਾ ਨੀਚਲਾਮਾਂ ਨੀਚਲਾ ਥਰਮਾਂ
 ਜੈਨਮਧਾ ਹੁਤਾ, ਤੇਮ ਛਤਾਂ ਫੈਵੀ ਪ੍ਰਕਾਸ਼ਨਾਂ ਕਿਰਣ੍ਣੇਨੇ ਤੇਮਨੀ
 ਨਾਨੀ ਅਵਸਥਾਮਾਂਥੀ ਜ ਤੇਮਣੁ ਬੁਝਣੁ ਕਰੀ ਲੀਧੇਲਾਂ ਹੁਤਾਂ.
 ਅਛਾ ਅਨੇ ਭਜਿ ਤਰੜ ਐਮਨਾਂ ਛੁਫਧ ਖੁਲਲਾਂ ਥਿੇਲਾਂ
 ਹੁਤਾਂ. ਸ਼੍ਰੀਪ੍ਰਭੁਨੇ ਤੇਓ। ਸਵੰ ਰੀਤ ਨੇ ਸਵੰ ਪ੍ਰਕਾਰੇ ਨੇ ਸਵੰ
 ਭਾਵੇ ਸਮਝੰ ਮਾਨਤਾ. ਤੇਓ। ਭਜਨੋਂ ਗਾਤਾ, ਉਤਮ ਪਵੋ
 ਖਨਾਵਤਾ, ਉਪਹੇਸ਼ ਕਰਤਾ ਨੇ ਸ਼੍ਰੀਪ੍ਰਭੁਨੀ ਗੁਦਗਢ ਕੁਂਠ ਪ੍ਰਾਥੰਨਾ
 ਪਣੁ ਛੁਫਧਥੀ ਕਰਤਾ. ਆਮ ਹੋਵਾ ਛਤਾਂ ਪਣੁ ਆਵਾ
 ਹਰਿਜਨ ਸਾਂਹੁ ਪੁਲਥੇ। ਵਿਖੇ ਛੁਫਧਨੋਂ ਪ੍ਰੇਮ-ਆਫਰ ਕੇਣਵਵੇ
 ਨੇ ਅੰਘੇਵੇ। ਵਿਚਾਰ ਕਰਵੇ—ਏ ਪਣੁ ਉਚਚ ਵਣ੍ਣੀਨਾ ਅੰਧ-
 ਅਛਾਗੁਅੇ। ਮਾਟੇ ਅਸਥਾ ਹੁਤੁਂ. ਆਵਾ ਹਰਿਜਨ ਸਾਂਤ-
 ਭਕਤੋਨੋ। ਤਿਰਸ਼ਕਾਰ ਕਰਵਾਮਾਂ ਆਵਧੇ ਛੇ, ਤੇਮਨੁਂ ਅਪਮਾਨ
 ਕਰਵਾਮਾਂ ਆਵਧੁਂ ਛੇ, ਪਵਿਤ੍ਰ ਸਥਣੋ। ਅਨੇ ਵਰੋਮਾਂਥੀ ਛੋਰਨੀ
 ਮਾਝਕ ਤੇਮਨੇ ਹਾਂਕੀ ਕਾਫਵਾਮਾਂ ਆਵਧਾ ਛੇ, ਤੇਮ ਛਤਾਂ ਆ
 ਸਾਂਹੁ—ਆਤਮਾਅੇ। ਜੰਨ ਪਣੁ ਤੱਥਾ ਨਥੀ. ਆਵੀ ਹਾਡਮਾਰੀ-
 ਅੇ। ਆਵੇ। ਤਿਰਸ਼ਕਾਰ, ਆਵੀ ਹੇਰਾਨਗਤਿ, ਤਥਾ ਅਨੇਕ
 ਫੁਨਡਗਤੋਨੀ ਵਚਚੇ ਪਣੁ ਤੇਓ। ਤੇਮਨੀ ਅਛਾਨੇ ਵਣਗੀ

રહ્યા હતા. તેમના હૃદયમાં જે પ્રકાશ પ્રકાશી રહ્યા હતો, તેના સૂચવેલા માર્ગે આગળ જવાને તેઓ સતત પ્રયત્નરીલ રહ્યા છે. જે લોકો તેમની કનઢગત કરતા, તેમના વિષે કંઈ પણ મનમાં હતરાજુ કે રાગદ્રેષ તેઓએ રાખ્યાં નથી. આ હક્કીકત હાલના જમાનાના આપણે ખધાં હરિજનોએ ખાસ લક્ષમાં રાખવાની છે. હૃદયની સદ્ગ્રાવના ન આદર ન સમભાવ જીવતોજગતો આપણા હૃદયમાં સવણું ગણ્ણાતા વગ્ય પરત્વે જગી ગયેલો હોવો જેઈશો, તો જ આપણે તેમનાં દિલ પિગળાવી શકીશું. કોઈનાયે જીવનનો પલટો કરાવવાને કાજે આપણે ચોતે જ આપણા જીવનને સંપૂર્ણપણે પલટાવી નાખતું પડશો. જીવનમાં જોંડો ઉત્કર્ષ પ્રેમભાવ પ્રકટ્યા વિના આપણે કંઈ કશું કરી શકવાના નથી, એનું પ્રભુકૃપાથી આપણને યોગ્ય ભાન જગો એવી હૃદયની પ્રાર્થના છે.

ઉપલા પ્રકારના હરિજન સંત-ભક્તોની જીવનમાં પ્રકટેલી જીવતીજગતી નમ્રતા, ભક્તિ અને સંપૂર્ણ સાધુતા હમેશાને માટે ધાર્મિક ઈતિહાસમાં તેમને અમર સ્થાન અપાવશે. આપણા ધાર્મિક ઈતિહાસમાં ઘણા-ઘણાયે વિવિધ પ્રકારનો અને અનેકરંગી ફાળો આપ્યો છે. ઘણા ઉમહાને સાસ્ત્રિક સાધુઓ, મહાન તત્ત્વચિંતકો અને તે તે સમયના યુગાવતાર સમા મહાપુરુષોએ આ મહાન આર્થ્રપ્રજાના જીવનને ઘરું છે. એ ફાળામાં આ હરિજન સંત-ભક્તોના અનરો ફાળો સમાયેલો છે.

ધર્મના પ્રહેશમાં શ્રીભુજ અને શ્રીશંકર ભગવાન તથા
એવા ખીજ ધર્માચાર્યો મહાન નહીંઓ। જેવા છે, તે
આ નાના નાના હરિજન સંત-ભક્તો નિર્મળ જરા
સર્માન તે છે જ. કોઈ ભૂલો પડેલો થાક્યોપાક્યો તરસ્યો
મુસાફર કે થાક્યો। એદૂત એના કિનારે બેસી એનાં
દંડાં અમૃત જેવાં જળ પી પી પોતે તાંલે બનશો,
નવીન જીવનની પ્રેરણા તે એમાંથી મેળવશો. આવા
સંત-ભક્તોનો જે વર્ગમાંથી જન્મ થયો છે, તે કોણા
તે બિચારા હજ્ઞયે અજ્ઞાન અને દુઃખમાં ઝૂણેલા છે.
તેમનો વસવાટ હજ્ઞયે ખાડેર જેવાં જૂપડામાં છે. તેમનાં
જીવન ગરીબાઈ અને દુઃખથી જરેલાં છે. ઉચ્ચ ગણ્ણાતા
સમાજ તરફથી હજ્ઞયે તેમની કનડગત અને હેરાનગતિ
થાય છે. એમના નંદ, ચોખામેળા, રવિદાસ ને હરિદાસ
જેવા અનેક સાધુ પુરુષો હજ્ઞયે તેમનામાં છે. તેઓ
શાંતિથી દુઃખો સહન કરી, રાગદ્રેષાદિ ત્યજ, સવા
પરત્વે સદસાવ અને સમતાથી વતી પોતાનું જીવન
વ્યતીત કરે છે. આ દુઃખ પામેલા પવિત્ર સંત-ભક્તોની
સાત્ત્વિક જીવનની સમરણગાથા આપણને આપણા ધર્મનું
યોગ્ય જ્ઞાનભાન કરાવો એ જ પ્રાર્થના છે.

સને 'ઉરની જેલયાત્રામાં આ નાનકડી પુસ્તિકાના
લેખકે આ હરિજન સંત-ભક્તોની ગાથા લખેલી.
તેમણે તે સંત-ભક્તોનાં જીવનચરિત્ર વિષે કોઈ પુસ્તકમાં
વાંચેલું. હશે, તે ઉપરથી તેમણે આશ્રમના ખાળકો

માટે આ સુરણુગાથા લખેલી હતી. તેમાં લખેલાં
ભજનો અને પ્રાર્થનાઓ. તેમનાં પોતાનાં તે સપ્યમાં
બનાવેલાં છે. આ ખંડું ઉતારવા કરવાનું હામ તો
શ્રી. હેમંતકુમાર નિલકંઠ કરેલું છે. સંપાદિકા તરીકે
મારાં નામ મૂકેલું છે એટલું જ.

હરિજન આશ્રમ, સાખરમતી }
તા. ૧૨-૨-૫૪ }

સુષ્પુટ રસુણુલાલ દલાલ

૩૮ વૃન્દ રિત્રો.

[આસુઅણી]

ભનાવતી-ગોપીચંદ ને જતું-		સુદામાચરિત્ર (કાંય) ૦)≡	૦)
હરિ ન વિઝન ૦)≡		શ્રી શુક્રહેષજ ૦)	૦
નેસલ-તેચલ તથા		જાલારત ૦)≡	૦
નલાંધર-ગોપીચંદ ૦)		નાનદ ૦)≡	૦
કખીર સાહેબ ૦)≡		બાળકોના વિકેકાનંદ ૦)	૦
ધાવણુની ધાર		કીર હતુમાન ૦)≡	૦
ને ખીજ વાતો ૦)≡		સતી સાવિત્રી ૦)	૦
મહાત્મા મરતરામજ ૦)≡		શી તેલાંગ સ્વામી ૦)	૦
વિશ્વામિત્ર ને હરિશંક્ર ૦)		ભંત અંબરીષ ૦)	૦
સંત મૂળદાસ ૦)≡		ભક્ત પ્રાહુલાદ ૦)	૦
ગોસ્વામી તુલસીદાસ ૦)≡		શ્રી રામકૃષ્ણ પરમહંસ ૦)≡	૦
ચંદ્રહાસ ૦)≡		સ્વામી રામતોથ ૦)	૦

સુરેનું સાહુત્ય વર્દ્ધક કાર્યાલય—ચુમદાવાદ

છાન્દુલાલ માર્ગ પટેલ
સાચા

હરિજન સંતો

૧ : રવિહાસ

ભારતની ધોરણ નિકા

ભારતવર્ષમાં પહેલાં કહીયે ન જોયેલી ને ન થયેલી એવી ધાર્મિક જીવલપાયલો મધ્યકાલીન શુગમાં થઈ. સમય પણ એવી કટોકટીનો ન હતો. કોઈ એક એવા મોટા ભૂકંપની પૂર્વતૈચારી થઈ ચૂકી હતી. ત્યારે જે રાજીઓ હતા તો પણ પ્રજાને રંઝડતા. અવ્યવસ્થા, જીવનમાટ ને જીવની નિશાનીએ પ્રત્યેક મનુષ્યના અહેરા પર કોતરાયેલી હેઠાતી. પરંતુ આના કરતાંચે મનુષ્યના જીવન પર જે કંચરે— મેલ અંદ્રો હતો, અથવા તો જે ભલિન આવરણ છવાયેલું હતું, તે તો ખાંદું હિસાખ વગરનું હતું. મિશ્યા કર્મકાંડ અને વહેમનું સાંક્રાન્ય જ્યાં ત્યાં અધે સ્થપાયેલું હતું. લોકહૃદયમાંથી વિશ્વાસ ને શ્રદ્ધા એસરવા લાગ્યાં હતાં.

આંધારી રાતે સંતોની દીપજવાલા

પણુ કેણુ જણે કેમ એક જખરજસ્ત પ્રથતન કરી, પોતાનું આળસ ખાંખેરી નાખી ભારતવર્ષ એક-દમ જગૃત બની ગયો. પોતાના ખળને સમયપણે એણે સંગઠિત કર્યું, ને ધર્મનું સાચું સ્વરાજ પ્રકટાવવા માટે તનતોડ પ્રથતન કરવા લાગ્યો. ધર્મના પરિવર્તનની તે હિલચાલોમાં અનેક સંત-ભક્તોએ કોઈ ચમત્કારભર્યો લાગ લજ્જયો. છે. પ્રણ-પ્રણ વર્ચ્યે જગેલા વેરને ભુલાવી ખધાંને એક રંગે રંગવાના અને એક દિલે થવાના પ્રથાસો થવા લાગ્યા. સંત રામાનંદ આમાં પહેલ કરી ગણ્ણાય. એમના પણી એમના પવિત્ર શિષ્ય કણીરે આ પ્રવૃત્તિને ખૂખ આગળ ધપાવી. શ્રીરામાનંદ એક નિર્મણ મનના, અતિ પવિત્ર, ધાર્મિક, આધ્યાત્મિક, વીર પુરુષ હતા. એમના સમયમાં અનેક ધાર્મિક સંસ્થાઓમાં જે સડો અને અન્યાય પ્રવર્ત્તા હતા, એ જોઈ એમનું હૈયું ધગધગી જઠતું. કેટલીકવાર તેમને મનમાં ઉદ્દેગ પણ થતો. કણીરે જે એક નવો ધાર્મિક વર્ગ જલો કર્યો હતો, તે એવા કોઈ વિરોધના જુસ્સા-માંથી જ જન્મ પામેલો હશે. હિંક, સુસલમાન, શીખ, હરિજન વગેરે સર્વ એક જ વર્ણના છે, સંસ્કારે લદે લેદ હોય, એલું તે માનતા ને તેનો પ્રચાર કરતા.

શ્રીરામાનંદનો સવિનય અનાદરે

સાધુઓના સામાન્ય સ્થિતિમાંના કોઈ સંઘના શ્રીરામાનંદ એક સાધુ હતા. સારાચ વેશમાં ઘણે ઠેકાળે ચાત્રાચે કરી કરી, તે જથારે મઠમાં પાછા પધાર્યા, ત્યારે મઠના ખીજ સાધુઓએ વાંધે ઉડાયે. તે એમણે આપણા સંઘના ઘણા નિયમોનો લંગ કર્યો હુશે. આથી ખીજ સાધુઓથી શ્રીરામાનંદને જુદા રહેવાનું ફરમાવવામાં આવ્યું. આ હુકમનો તેમણે સવિનય અનાદર કરી પોતે તે સાધુઓના સંઘમાંથી નીકળી ગયા ને નવી વર્ગપદ્ધતિ શરૂ કરી. પછી તો સારાચે ભારતવર્ષમાં એનો પ્રચાર થવા લાગ્યો.

સંત કુખીરની ધાર્મિક એકતા

એમના પછી ભક્તાકૃતિ કર્ણિર થયા. જીવનમાં એ નિર્ભય થયેલા હતા. સમાજનાં ખોટાં બંધનોને, અયોધ્ય ઢાદિઓને તોડીક્રોદીને લુઝ્કો કરી નાખવા તે હુંમેશાં તૈથાર રહેતા. ‘આ સર્વ જગત પ્રભુમય છે, તો પછી આ ખધા લેદ શા !’ એવા તત્ત્વજ્ઞાનો બાધ પોતાના જીવનના વણુતરમાં એમણે વણી લીધે હતો. પોતાનું આખુંચે જીવન આ મહાન કાર્યમાં તેમણે સમર્પેલું હતું. પોતાના સમગ્ર ખળથી, જુસ્સાથી, ઉત્સાહથી, ખંતથી, સાહસથી, હિંમતથી, ધીરજથી તેમણે તે કામ કરવા માંડયું. હિંક, સુસલ-

માન, રીખ અને હીજુ અધી કેામોને એમણે પોકારી ચોકારીને કહું કે, ‘તમે એક જ સર્વોદ્યાપક અને સત્યમય પ્રભુને લન્ને.’ એમના પંથનો પ્રચાર ચારે દિશામાં ફેલાવા લાગ્યો. નાનકે પંજાખમાં એવા જ એક નવા ધર્મનાં ખીજ વાળ્યાં. આથી જગતમાં ધાર્મિક ઔદ્યની લાગણી પ્રકટવા લાગી. પ્રબુ સંગઠિત થની. વેરભાવ ઘટવા લાગ્યો. માંહેમાંહેનો કલહ ઘટ્યો અને તેમના ધાર્મિક પંથના માણુસોમાં એક જાતની નવીન ધાર્મિક ઉત્સાહજનક મર્દાનગીલરી જગૃતિ પ્રકટી. એ કેામ સંગઠિત રીતે, સહકારથી, ધર્મને જ પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાને હૃદયથી તત્પર રહેતી.

શ્રીચૈતન્ય મહાપ્રભુ

આવી જ રીતે ખંગાળમાં શ્રીચૈતન્ય મહાપ્રભુએ પ્રચાર કર્યો. લક્ષ્મિનો સુલભ માર્ગ એમણે સૌને અતાંયો. એમની ધર્મભાવનામાં ઊંચ કે નીચનો લેદ કથાંચ ન હતો. અધ્યાત્માને એકસરણો સમાન અધિકાર હતો. આ ચૈતનાથી કરી ખંગાળ એને ભારતનો પૂર્વ કિનારો અજ્ઞાનની ઊંઘ અને આળસ છાડી જીવનને ઘેરી રહેલા તમસને લગાડવાને જગી ઊઠ્યો. મધ્ય હિંકુસ્તાનમાં શ્રીરામાનંદ ને શ્રીકથીરના પ્રચારથી અનેક સંતલક્ષ્ણો પેહા થયા. તેમણે

પોતાના ચારિયાખળથી અને લક્ષ્ણથી પ્રજને
વર્ણ—વર્ણ વર્ચના લેઠ ભુલાવવામાં ખૂબ પ્રેરણું
આપેલી છે.

નીચલા થરની ગણ્યાતી કોમોસાં પણ ધાર્મિક શૈલના

આવા ઉપર પ્રમાણેના પ્રચારથી ભારતવર્ષની
નીચલા થરની ગણ્યાતી કોમોસાં પણ ધાર્મિક
જગૃતિનું એક નંતું પ્રચંડ મોંજું ફેલાઈ ગંધું.
એમને પણું પ્રખુની સેવાલક્ષ્ણિતનો હક્ક છે, એમને
પણું આત્મા છે, આત્માની વેલ છે, એમને કૂલવા—
કૂલવાનો અધિકાર છે, ને એમનુંથે જીવન પુણ્યની
ઘેણે ખીલવાને માટે સમાન સંભેગો ને સસાન અધિ-
કાર મારી લે છે—આવા પ્રકારના પ્રચારથી એમના-
માં વિશ્વાસના આંકુરો કૂટવા લાગ્યા. રૈતીના રણ જેવા
એમના સૂક્ષ્મા જીવનમાં એમને હવે કંઈ રસ પડવા
લાગ્યો. જીવનમાં આનંદ છે, આહૃતાદ છે, જીવન
જીવવા જેવું છે એમ તેમણે પ્રથમવાર જીવનમાં
અનુભૂયું. આવી નીચલા થરની ગણ્યાતી કોમોસાંની
ચમાર કોમમાં પંદરમા સૈકામાં એક એવો સાધુ
પુરુષ પાકયો કે જેનું પુણ્ય સમરણ ઉદ્ઘસિત હુદ્ધયે
પ્રેમલક્ષ્ણિતભાવથી આજે પણ સમાજ કરી રહેલો છે.

સંત રવિદાસે નવી જ ક્રોમ ઊલ્લી કરી
આ સાધુ પુરુષનું નામ રવિદાસ હતું. એમના
જીવનની કથા સાથે ઘણી ચમતકારિક દંતકથાએ
વળ્ણાઈ ગયેલી છે. તે સાચી હોય કે એટી હોય,
પરંતુ એ ઉપરથી એટલું તો ચોક્કસ છે કે એમના
સમયમાં એ ઘણ્ણા વિખ્યાતિ પામેલા તો હશે જ.
તેમનાં કેટલાંક લજનકાવ્યો આહિ શ્રીઅંથસાહેભમાં
સ્થાન પામેલાં છે અને આ હિવસે પણ એમનાં
લજનો કાર્યીમાં ગવાય છે. એમ કહેવાય છે કે,
રવિદાસે પોતાની કોમોભાંથી એક નવીન જાતિ
ઉત્પન્ન કરી હતી અને એને આચારવિચારે અને
લાવનાથી શુદ્ધ બનાવી હતી. લક્ષ્માળમાં શ્રીરવિ-
દાસનું ચરિત્ર સુંદર રીતે આલેખાયેલું છે.

શ્રીરવિદાસનો ચસારનો ધંધો.

શ્રીરવિદાસ હિંકુ જાતિમાં નીચી ગળ્ણાતી એક
કોમમાં જન્મ્યા હતા. એમનો ધંધો ચામડાં કેળવવા-
નો હતો. ગરીબ માણુસને વેર જિધર્યા હતા. એમના
ધંધામાં તે પારંગત હતા. નાનપળુથી જ રવિદાસ
દશ-આચહી સ્વલાવના હતા. ચામડાં કેળવતાં કેળવતાં
તે અલુસમરણ કરતા, લજનો ગાતા.

કુરખાનીની તમના

(ગભલ)

અરણુ કુરખાની કરવાની હવે તો બસ તમના છે. (૨૫)
 જિગર સોંપી દીધા કેડે, નકામા તક શા ખ્પના!
 હવે તો થાય તે જેયા કરી સૂહેતું રહ્યું તેમાં. અરણુૠ
 અરે! કિસમત! ડે શાને? ખુવારી છો ભલે થાતી;
 જગતભરને અતાવી હે, સમર્પણુમાં મજા કેવી! અરણુૠ
 મહેષુદ્ધત મોત સારે છે, અરે! તેથીથ પણુ કપરી;
 ઇના થાવા છતાંયે તે મળે નિશ્ચિત ના કાંઈ. અરણુૠ
 નિરાશા ગ્રેમમાં તારા હૃદયનાં દદ્દી, લહેનજત છે;
 અરણુ કુરખાની કરવાની હવે તો બસ તમના છે.

સતત સસરણુ

(હરિંગીત)

વિસરાય પળ નવ એક તું એ દાન હેળે દીનને. (૨૫)
 ઝુદ્ધિ, મન, ચિત્ત, પ્રાણ એ હોમાઈ તુજમાં ના ગયાં,
 એ સૂર બસૂરે કાદતાં, પ્રભુ! એક કરવાનાં રહ્યાં. વિસરાયૠ
 એ મેળ કયમ એસાડવો? ઇંદ્રાં બહુ મારી મથું;
 મારું કશું નવ ત્યાં ગળું, કાં બળ હૃદય નવ હે પ્રભુ! વિસરાયૠ
 મુજ રાંક જીવનની પ્રભો! સોંપી દીધી હોરી તને;
 શક્તિ વિવેકની આપને અત્યેક કત્થોએ મને. વિસરાયૠ
 જે હરિ—અરણુ સાહી રહ્યા, આનંદધામે જઈ વસ્થા;
 મુજ થતન આછા કાંઈથતા, તુજ હાથ તે ઝળવા રહ્યા. વિસરાયૠ

એ સ્વર સુજ ઉરનો સુણી, હરિ ! રવડતા આ બાળને,
વિસરાય પળ નવ એક તું એ દાન હેલે દીનને.

પ્રલુને આવી રીતે ઝુદ્ધયના સાલતા દર્દથી
ઘણી વાર તેઓ ગ્રાર્થના કરતા; અને ઘણીએ વાર
તેવા ભાવની તદ્વીનતામાં લચ પામી જતા. ધંધા-
માંથી જે કંઈ થોડાઘણો નફો મળતો તે સાધુ-
સંતોને તે વહેંચી આપતા.

કુઃખમાંચે શર્જા તથા સેવા

પરંતુ ભાગ્યવશાતુ દેશમાં કુંકાળ પડ્યો.
તેને કારણે આંપણું આ ગરીબ રવિંદાસને ખાડું
કુઃખ વેઠલું પડ્યું. અનેક કુઃખની પરંપરાએમાંથી
તેમને પસાર થલું પડ્યું. જીવનની આવી કટોકટીના
પ્રસંગો પણ તેમણે કોઈની પાસેથી કશું લીધું નથી;
ગલટું પોતે ઘણુંનું પોષણ કર્યું છે. કેટલીક
વખત એમણે જતે ભૂખ્યા રહીને પણ ધીજાંએને
જિવાડ્યા છે. પોતાના જીવનના અતિ વિકટ પ્રસંગો-
માં એ પ્રલુને ભૂખ્યા નથી. કુઃખની ઉત્કટમાં
ઉત્કટ કસોટીએ ચઢ્યા હોવા છતાં એમનો પ્રલુ
પરનો વિશ્વાસ વધારે દ્વદ્દ અને તેજસ્વિત ખન્યો
હતો. પોતાનું સર્વસ્વ એમણે પ્રલુચરણે સમર્પણુ
કરેલું હતું.

હૃદયના ગ્રેમબાવનું લક્ષણ

(ગજલ)

અરણુમાં ખાખ થઈ મરવું, પ્રણયની એ નિશાની છે. (૨૫)
 હૃદય સોંપી દીધું તુજને, રહ્લું ના હાથ તે મારે;
 સકંચે લઈ મને શાને હવે નાહક સતાવે છે? અરણુમાં
 હૃદયથી ડ્રિમ્બિંએ જાગી પળેપળ તુજ સ્મૃતિ જગવે;
 સ્મૃતિપટમાં ઘડી આવી જતો છટકી વળી કૃથાયે! અરણુમાં
 તમારે મન રમત છે ને અહીં તો જન રૂકેંસાયે;
 તલસવામાં છતાં એવું પ્રભુ! અડ્ઝોભાષ્ય મારું છે. અરણુમાં
 ઇના થાવાનું હું ધર્મશ્રું હૃદય તુજ ઉગ્ર તલસાટે;
 અરણુમાં ખાખ થઈ મરવું પ્રણયની એ નિશાની છે.

કચડાચેલું હૈયું

(ગજલ)

પ્રભુ! કચડાચેલું હૈયું; કૃપાથી તે તું કર હળવું. (૨૫)
 ઉકેલું શી રીતે મારી પડેલી ગૂંચ આ હૃદયે?
 વિટમણા આ મથામળની શકું સમજવી શી રીતે? પ્રભુ!
 પડે નવ ગમ ખીજને ત્યાં; મને શું ના શકે સમજ?
 કરું ત્યાં શું પ્રભુજી! હું? દિલે છે ભાર એચેની. પ્રભુ!
 કથા કથવા જતાં મારી હુનિયાને પડી ના છે;
 પડ્યાને પાકુ હેનારી, ન મારો ત્યાં ઉમળકો છે. પ્રભુ!
 સુહુદ મારે પ્રભુ! તું છે, નિકટનો તું નિકટ મારે;
 વળી તું આત્મજન મારું તને સંભળાવું તેથી તે. પ્રભુ!

પહાડો ને પહાડોના પ્રભુ ! ભારે લદાયેલું;
અને કચડાયલું હૈયું, કૃપાથી તે તું કર હળવું. પ્રભુ૦

આવી જાતના હૃદયના સાલતા દર્દો તે વેળા
તેઓ પ્રાર્થના કરતા. પોતાનું પ્રત્યેક કર્મ પ્રભુને
સાક્ષી રાખી તે કર્યા કરતા. ગરીધા, ભૂખયા, માનવ
અંધુઓને નિહાળી તેમનું હૃદય કકળી જઠતું. પોતે
જ્યારે અતિશય હુઃખુથી પીડાતા, ત્યારે તે પરમ
કૃપાળુ પ્રભુને પ્રાર્થના કરતા કે ‘પ્રભો ! એવાં તે
અમારાં શાં પાપ છે, કે આવાં કારમાં હુઃખ અમારે
સહન કરવાં પડે છે !’ પણુ પાછા પોતાની જાતને
સંઝોધીને ગાતા કે :-

તારે ભરોંસે

(ગંગલ)

હવે તારે ભરોંસે છું, પ્રભુ ! સુજને સ્વીકારી લે. (૨૫)
સહુ અપરાધીમાંયે છું, પ્રભુ ! અપરાધી છું મોટો;
પતિતમાંયે પતિત છું તો, ન જેનો કયાંય છે જોટો. હવે૦
પ્રભુ ! તાયે શરણ છું તો ચરણ તારે પડેલો છું;
ઉગારે કે ભલે મારે, ધરું એની ન ચિંતા હું. હવે૦
મને તુજ મારવામાંયે પ્રભુ ! હિત સુજ સમાયેલું;
કદી તક્કે-વિતક્કે તે પ્રભુ ! તેથી ન મન જોકું. હવે૦
હું તો બસ એટલું જણું ‘ધરેણું રાંકનું મારું ;’
સદા રટવાનું ઉરચાડું પ્રભુજ ! નામ તુજ પહાલું. હવે૦

મને ઝૂખતાનું સાધન તે મળ્યું તારી હૃપાથી છે;
પ્રભુ! તે પ્રાણુથી ખાલું હવે લાગે હૃદય મુજનો. હવે૦

(શિખરિણી)

અલાવે વિશ્વાસે જીવન નિજનું જે તુજ પરે,
સહાયે તું એનું જરૂર સધળું ક્ષેમ અલવે;
જગ્યાંયું છે એવું જગતજગતનો સાટ કરી તેં,
છતાયે હું મૂર્ગો કંઈ ન સમજું, હે મતિ મને.

એમ કરી પોતે પ્રભુચરણુમાં જ્ઞાનલક્ષ્મિલાવે
સંપૂર્ણ રીતે સમર્પણ થઈ જવા, અને એના જ
ભરેંસે પોતાની જીવનનૌકા અલાવવા સતત હૃદયથી
એકધારે ગ્રધતન કરતા.

એકનિષાની કસોટી

શ્રીરવિહાસને સાંસા પડવા લાગ્યા, લારે
લોકોની એમ કહે છે કે જગવાને એક વૈષણવના વેષે
રવિહાસને પારસમણું આપ્યો; પરંતુ તેમણે તે તરફ
કંઈ ધ્યાન આપ્યું નહિં. અને ગાવા લાગ્યા કે :-

‘પ્રભુનું નામ એ જ મારે મોટામાં મોટો
લાંડાર છે. કદી તે ખુટાડ્યો ખૂટાડ્યો નથી. દિવસે
દિવસે તે વધે છે, અને ખૂણી તો ત્યાં છે કે જેમ
જેમ તે ખારચીએ, તેમ તેમ તે વધે છે. મારી
માલમિલકત કે લક્ષ્મી-જે કહું તે-એક શ્રીપ્રભુ
પોતે જ છે. તો હવે એ માયાના પારસમણું

પથ્થરની મારે શી જરૂર ?' એમ જણી પેલા
ચમતકારી પથ્થરને તેમણે તો ઝગાવી દીધો.

મારે તો કૃપા જ જોઈએ છે

તેમ છતાં પણ ભક્તો જેને પ્રાણુથી પણ
અધિક વહાલા છે, એવા તે પરમ કૃપાળું શ્રીપ્રબુએ
રવિદ્બાસને સોનાનું દાન દેવાને ખૂબ આથડ કર્યો;
પણ તેમનું મન માનતું ન હતું. કંચન અને કામ
ભક્તાના માર્ગેમાં આડળીલીરૂપ છે. મારા પ્રિય
પ્રબુથી મને વિખૂટો પાડે, એવું તે દાન જે લઉં, તો
પણી મારા જેવો ગરીબ કે જે સારાયે સમાજમાં
તિરસ્કૃત થયેલો છે, તેને ક્યાં સ્થાન રહે ? ના, ના,
અલો ! મારે એવું કંઈ જ જોઈતું નથી. મારે તો માત્ર
જોઈએ છે, એક તારી કૃપા. એમ જણાવી ગાતા કે :-

(વસંતતિલક)

ઓળંગશે ગિરિ કૃપા થકી પંગુ તારી,
ને મૂક વાત કરશોય કૃપાથી તારી;
તારી કૃપાથી તૃણ મેરુ થશે પ્રબુ તે,
—માણું કૃપા અવર આશ કંઈ નહિ છે.

(શિખરિષ્ણી)

કૃપાથી તારી તે મૂરખ પણ વિકાન બનશે,
કૃપાથી તારી તે બધિર જનના કાન ખૂલશે;

કૃપામાં તારી તે અતુલ પ્રભુ, સામચ્યો રહ્યું છે,
કૃપા હું માગું તે; અવર બસ ના આશ કંઈ છે.

અમંગળ શાંકાચોનું નિરસન

કેટલાક દિવસ પછી શ્રીરવિદ્વાસને અમંગળ
શાંકાચો થવા લાગ્યો, ને એમના મનમાં કોઈ હૈવી
ક્રાપની ભીતિ ચેઠી. લ્યારે તે ગાવા લાગતા કે:-

(શિખરિણી)

ખીજન કોણી તારા વગર પ્રભુ! આશા મન ધરું,
ખીજન કોણી તારા વગર કંઈ માગું મહદ હું;
ખીજન કોણો તારા વગર ભથ રાખું ન મન હું,
ખીજન કોણો તારા વગર નવ હું આશ્રય લઈ.
પ્રભુ! માયાનાં આ વમળમહીં હું દૂખી મરું છું,
પછાડા મારું છું, પદ-કર થકી—કૈ ન વળતું;
ઝંધાયું છે એથી મુજ જીવન, તો તો પ્રભુ! હવે,
કૃપા—નૌકા તારી, લળી વિનિયું, તું આપ મુજને.

x

જીવ્યાં'તાં ને પુણો મુજ જીવનવાડી મહીં ખીલ્યાં,
વિકારી તાપેથી બહુ જ કરમાઈ સહુ ગયાં;
લીલી વાડી મારી અરર! પ્રભુ! વેરાન થઈ શા!
અરે! આવી સિંચો તમ જ્ઞાન કૃપાનું પ્રભુ! ત્યહીં.

પ્રભુ—દત્ત મંહિરના પૂજારી

આખરે કોઈ હૈવી અવાજો, પ્રભુ ને દ્રષ્ટયાએ છે, તે લઈ લેવા તેમને જણાયું. એ દ્રષ્ટયાથી પ્રભુનું મંહિર ધનાવવાનું સ્વીચ્છાયું. તેમણે તે પૈસાથી એક સુંદર, લાંઘ ને કળાત્મક મંહિર ધંધાયું. આ મંહિરમાંના લગાવાનના તેઓ પોતે જ પૂજારી ધન્યા. એ રીતે તેઓ સાધુ—સંત—લક્ષ્મોમાં ખૂબ જાણીતા થયા.

શ્રીરવિદાસ કેટલીક વાર પ્રભુની ગાહગાહ કંઠે આર્થના કરતા, પ્રભુને મોટા સ્વરે હોલાવતા, કેટલીક વાર ગાંડા લેવા ધની જતા ને જાણે કે પ્રભુને ઠપકો ન હેતા હોય, તેમ કહેતા કે :-

વલચલાટ ને કાલાવાલા

(શિખરિણી)

ધણુંયેને તેં તો હુદય અપનાયાં, કથમ મને પ્રભો! બાકી રાખ્યો? તુજુ અવકૃપા કાં સુજ શિરે? ચખાખ્યો છે તેં તો અમર રસ, અમૃત કંઈ ને, અભાગી બાકી હું પ્રભુ! રહી ગયો એક જ ખરે.

×

દલ્યાં ને ને તારે પહેલાં, તેં તે સકળને હુંદે ચાંપ્યી, દીધાં રસિક મીઠાં ચુંબન ખરે!

લીધાં સૌ આકષીં તુજ હૃદયમાં એમ કરીને,
મને ખાકી રાખ્યો, વિનુ શું પડી હું જત તુજને?
ખીજાંઓ વૃહાલાં ને અપ્રિય પ્રભુ! કાં હુંજ તુજને?
ખીજાંને લે હૈયે, દગ પણ ન હેંકે મુજ પરે!
ખીજાંને સારકારે તુજ મલકતા હાસ્ય થકી તે,
મને કાં ધુતકારી દૂરજ હડસેલી પ્રભુ! મૂકે?

×

વિના જ્ઞેયા તારું ડ્યુ, તુજ પરે મોહિત થયો
પ્રભો! લાગે ખારો અધિક મુજને પ્રાણું થકી તું.
મને જ્ઞેવા તારું રસિક પ્રભુ! સૌંદર્યું મધુરું
મહત્વાકંક્ષા છે, નજર કરીને ધર્ય કર તું.

આમ તે સતત હૃદયમાં હૃદયથી વલવલાઈ
ને કાલાવાલા કર્યો કરતા.

અનુભવાત્મક અષ્ટા

(ગીતલ)

જીવનમાં કેટલી વારે ફુપાદિષ્ટ બતાવી છે! (૨૫)
જીવનનો ભાર શો જીપડે! પ્રભો! બધું આકરું લાગો;
મરણું આથી બદ્ધાં લાગો, ધડીભર એમ મન માગો. જીવનમાં
ધીરજ, સાંહસ અને અષ્ટા, બધા પુરુષાર્થના ગુણો,
ગયેલા તે સાંહ દીસે, નથી રસ જીવા કેરો. જીવનમાં
જીવનમાં આવી પળ જ્યારે મને આવી હતી જ્યારે,
કરણુાત્રાદિની જડીઓ પ્રભો. વર્ષાવી મુજ પર તે. જીવનમાં
અનુભવ તે ઉપર મારા જીવનનું નાવ હાંકું છું,
રખે જેને! જતું ભાંગા પડી પાયે હું વીનવું છું. જીવનમાં

એમ વારંવાર હૃદયમાં હૃદયથી પ્રાર્થના
કરી કરી શ્રીપ્રબુને ગાહગાહ લાવે તેઓ વીનવતા.
એમના હૃદયની ભક્તિનો લાવ, જે જે તેમને
સાંભાગતા, તેમને સ્પર્શાતો. એમની ઝોરમ કથાંચે સુધી
ફેલાઈ ગયેલી હતી.

લક્ષાને કષ તો ખડે જ

પરંતુ આ અધી અવસ્થાએ સહેલાઈથી
એમની એમ કંઈ પસાર થયેલી નહોંતી. પ્રત્યેક
ડગાલે ડગાલે એમને વિરોધ સહન કરવો પડતો.
ઉચ્ચ ગણુંતો વર્ગ એમને ધાણું ધાણું ધમકાવતો,
હેરાન કરતો ને પજવતો. એમની અનેક પ્રકારે
ઠુઠામંકરી પણ કરતો. અમાર, તે વળી મંહિર અંધાવ-
નાર કોણ ! ને વળી એ પાછો પ્રબુનો પૂજારી
અને ! અરરર ! હવે તો હડહડતો કલિયુગ આવ્યો.
ધર્મનું જીત્યાનાશ જવા એહું છે ! સમાજના ધાણુંચે
લોકો એમને અનેક રીતે સતાવતા. તેમના પ્રત્યેક
કાર્યમાં તેઓ વિદ્ધ નાખતા, અને એમને આડ-
ગીલીરૂપ અનતા. એમની સાથેનો સઘણો સહકાર
પણ સમાજે અંધ કર્યો હતો. તેમ છતાં પણ,
લીધેલું કામ ગમે તેટની ચુશકેલી હોવા છતાં પણ
પાર પાડલું, એવા એ ભરણિયા નિર્ધારવાળા, દઢાયહી
સ્વભાવવાળા હતા. પ્રબુ પર એમને અપાર શ્રદ્ધા
અને વિશ્વાસ હતાં, તેથી તે ડગા નહિ.

સત્યાનાશ !

આથી તે સ્થળના પ્રાણીઓ, પંડિતો ખૂખ
મૂંઝાથા. તેમનું કાસળ કાડી નાખવાને કાજે કંઈક
કંઈક ચુક્કિતાઓ શોધવા ને રચવા લાગ્યા. આપણાને
તેમને એક દ્વારા જરી આવ્યો. તેઓ તેમના
રાજ પાસે ગયા અને ફરિયાહ કરવા લાગ્યા કે
'મહારાજ ! હવે આપણા રાજ્યનું અને ધર્મનું
સત્યાનાશ વળવા હોઢું છે. એક અતિશાસ્ક લગવાનનું
મંહિર ખાંદચું ને વળી તે પોતે જ તેમાંના લગવાનનો
પૂજારી બન્યો છે. રાજ્યમાં હવે લયંકર ભૂખિમરો,
રોગ ને મૃત્યુ એવી ત્રિપુરિનો પંજે પડવાનો; કારણ
કુ પત્રિત એવાં દેવમંહિર ને દેવપૂજા આપણા રાજ્યમાં
નીચ ગણ્યાતી ચમાર કોમ કરે છે. હે રાજન ! એક
ચમાર વિષણુની પૂજા કરે છે, ખધાને એકઠાં કરી
પ્રસાદ પણ વહેંચે છે; માટે રૈથતનાં ધર્મ ને સ્વમાન
જળવવા આપ એનો નાશ કરો.

ભક્તિની સાધ્યતી આપ

રાજએ તેથી કરી તે સાહસિક ભક્ત ચમારને
છાલાવ્યી મંગાયો. મંહિર અને તેમાંની શ્રીલગવાનની
મૂર્તિ પ્રાણીને સોંપી દેવા તેને ફરમાયું. શ્રીરવિ-
દાસે જે કે નાભાવે હા તો પાડી, પરંતુ તેમ
છતાં રાજએ તો તેમને ધમકાવીને કહ્યું કે 'મોટો'

પ્રભુનો લક્ષ્ય થયો છે, ને એવો ડોળ કરે છે ને
એવું તું અભિમાન રાખે છે, તો હવે તે તું સાધિત
કરી અતાવ. નહિતર તારે આવી બન્યું સમજજો.'
ગરીધા બિચારે રવિદાસ તે વેળા ખીંચું તો શું કરી
શકે? પણ એણે તો પ્રભુને સાદ કરો :-

(શિખરિણી)

કરું ખુલ્લું હૈથું તુજ વગર કો આગળ પ્રભુ?
તને જે ના મારું હુઃખ કથું, ખીજે ક્યાં જઈ રહું?
ભલે ખીજ છો ના સુજ જીવનનો મમ સમજે,
પ્રભુ! તું તો જણે સુજ હુદ્દય શા માટ તલસે?
'હીનોનું તું સાચે જગમહિ' પ્રભુ! રક્ષણું કરે,
પ્રભુ! એ વિશ્વાસે સુજ જીવન મેં સોંઘું તુજને;
હવે તારે હાથે સુજ ગરીબની લાજ રહી છે,
સદ્ગ્યે છું તારે શરળું પ્રભુ! હું પાપી જન જે.
પ્રભાવંતાં ઉપા-કિરણું તમનો નાશ કરતાં,
અને દેલાવે છે જગત પર તે ચેતન નવાં;
પણ તે વિસ્તારે નિજ કર અણુંઘે અણું મહીં;
કૃપા તેવી તારી સુજ પર તું વર્ણવ પ્રભુજ!

અંકમાં રમાડો

(વૈદરભી વનમાં વલવલે-એ ઠાળ)

અંકમાં રમાડો આળ વીંદું, પૂરે ઉરના અભિલાખ; અંકમાં
દીનનો હ્યાળ છાડી ક્યાં જાણું? દીન-ધર તુજ પાદ;
ચોંઝો મંકાડો ન દ્યુટશો, તેમ પડ્યો છું પાદ. અંકમાં

રવિદાસ

નિભાબ્યો મને હેતે કરી પ્રભુ! જણું તુજ ખાળ;
 હરિ! તેમ દ્વારા સહુ દાખની, કરી નિજનો, તું પાળ. અંકમાં
 એકાં અનાથના નાથ છો, કેંકા હૃપામય કટાક્ષ;
 હેતે લઈ મને ચાંપણે ટળો જય સંતાપ. અંકમાં
 ભાવાશું અંજલિ અપું હું, યાચું, પૂરે સુજ આશ;
 સુદ્રિત અંકિત હેઠ થઈ વસો હરનિશ પાસ. અંકમાં
 આશ્રય ઉર તારો ધરું, શિરે ગજીતો નાથ;
 કહી વિસારશો ખાળ ના, લ્યોને અંક ગ્રહી હાથ. અંકમાં

આવી આવી આર્થના હૃદયથી હૃદયમાં તેઓ
 કરવા લાગ્યા. પ્રભુને અનેક ભાવથી કરગરી કરગરીને
 તેઓ પોકારવા લાગ્યા. કોણું જણે કેમ રાન્ને કોઈ
 અદેશય ચમતકારથી શ્રીપ્રભુની પૂજ કરવાની રવિ-
 દાસની ચોગ્યતા વિષે હિલિમાં ખાતરી થઈ ગઈ અને
 તેથી એમને છાડી દીધા.

સહુ કોઈનાં ભાથાં નસ્યાં

એમના જીવનમાં એક ખીલે પણું એવો પ્રસંગ
 છે, કે ખણું અદ્ભુત જોવો લાગે છે, છતાં પણું તે પરથી
 તે કેટલાં ખંધા લોકપ્રિય અને લોકમાન્ય હુશો એની
 આપણુંને સાખિતી મળે છે. એમના સમકાલીન
 સંત-ભક્તોમાં એમનું સ્થાન ખણું ઉચ્ચય હતું. હું મેશાં
 તે નાન રહેતા. ખાણું પંડિતોએ તેમને સતાવવામાં
 ખાકી રાખેલી નહિ. છતાં મનમાં તેમના પરત્વે કહી

હરિજન સંતો.

૨૬

તેમણે આપુંગમે આપેલો નથી. તેમને ધણુા શિષ્યો
પણ હતા. તેઓમાં ચિતોડનાં રાણી પણ એક હતાં
એમ કહેવાય છે. તેમના રાજ્યમાં ખાલ્સાણુ આદિ
જુદ્યે વર્ણમાં તેથી ભારે ખળગ્યાટ પણ મચી
ગયેલો, પરંતુ જ્યારે કોઈ એક ખાસ પ્રસંગે રાજ્ય
તરફથી ખાલ્સાણુ-સોજન આપવામાં આવ્યું, ત્યારે
ખળણે ખાલ્સાણુની વર્ણે એકેક રવિહાસ જેઠેલા તેમના
જીવામાં આવ્યા. આથી તેઓ ખૂબ ખૂબ નવાઈ
પાડ્યા. શ્રીરવિહાસનું શુદ્ધ ચારિય ને એનાં પ્રભુ
પરનાં શ્રદ્ધા-વિશ્વાસ ને એમની લક્ષ્ણ માટે એમના
મનમાં ધર્યો જાંચ્યો ખાલ જેઠો.

સંત ચમાર હૈય તોપણું આપણામાં પૂજાય
 એક અંગેજ ધતિહાસકાર-વિલસન શ્રીરવિહાસ
 માટે લખે છે કે એની લુધનકથામાં વર્ણવેલા ચમ
 કારો માટે આપણે ગમે તે ધારીએ, પરંતુ એની
 આંદર સમાચેલ અને એની અંતરખણુરનો અંતરપ્રવાહ
 તો આપણુને સ્પષ્ટ ખતાવે છે કે હિંકુ કોમની નીચામાં
 નીચી તિરસ્કૃત જાતિમાંનો એક ચમાર સંત સાંધુ
 પુરુષ તરીકે કેટકેટકી જાંચી કલ્યાણે પહોંચેલો હતો.

૨ : વ્યાખ્યામેળી।

મહારાજ્યને સંતોચે જગડયું

મહાબલીન ચુગના ધાર્મિક વાતાવરણુમાં જે ભારે અગભળાઈ અને અળવો જન્મયા હતા, જે ધાર્મિક સુધારાનો પ્રચાર ઉત્તર હિંદુસ્થાનમાં થયો હતો, તેની અસર મહારાજ્ય પર પણ ખૂબ પડી હતી. ત્યાં પણ ધ્યાનહેવ, જ્ઞાનહેવ, નિવૃત્તિનાથ, તુરારામ, નામહેવ આદિ સંતોચે એક જ પ્રકારની ભાવનાનો ખૂબ ખૂબ પ્રચાર કરવા માંડેલો. તે ધાર્મિક સાત્ત્વિક હિલચાલે ત્યાં બહુજ સુંદર અને સંગઠિત સ્વરૂપ પકડયું હતું. જ્ઞાનહેવ આદિ સાધુ પુરુષો આળાંહી ગામના હતા. તેમને જ્ઞાતિખાર મૂકવામાં આવેલા. જ્ઞાનહેવ, નિવૃત્તિનાથ આદિ સંતો જાહેર રૂપે હિંમત-પૂર્વક કહેતા કે યજયાગ ને કર્મકંડ કરતાં શક્તા, વિશ્વાસ ને જક્તિભાવવાળો ધર્મ અનેક રીતે ચાંદિયાતો છે. વળી શ્રીલગવદ્ગીતા જેવા નિદ્રલોઽય થાંથને મરાઠી ભાષામાં સુંદર રીતે ઉતારી સર્વાભાન્ય જનતાને માટે એમણે સુવલ કરી મૂક્યો. મહારાજ્યના સારાચે પ્રહેશમાં સુસાક્ષી કરી જ્યાં ત્યાં લોકોને જ્ઞાનનો ઉપહેશ આપવા માંડ્યો. એમણે તો આખાચે જનસમાજના કલ્યાણ માટે જાનની પરખ

માંડી હતી. આથી ખાલ્સાળ વિક્રાન સમાજની મહત્તમાને ને પ્રતિધાને મોટામાં મોટો ફટકો પડ્યો. આવા સંતોની ભાવનાનો પ્રચાર કરવામાં હીજ અનેક સંત લક્ષ્ણ-કવિઓએ પણ ભાગ લજીયો છે.

કુઠ નીચલા સમાજના થરમાં પાવક-જવાળા

મહારાષ્ટ્રની જનતા ઉપર આની ભારે અસર પડી. તેથી તેમનામાં સામાજિક અને ધાર્મિક સ્વતંત્રતાનું પ્રચંડ લેમ પ્રકટી નીકળ્યું. સમાજની નીચલા થરની કોમોમાં પણ સંત-લક્ષ્ણો પેઢા થયા. કુંભાર, મોચી, દરળ, હળમ, રખારી વગેરે કોમોમાંથી પણ લક્ષ્ણ, કવિ અને સંત પાકયા. સંતોની આવી પાવક-જવાળા હુડ્ધૂત ગણ્યાતી હરિજન કોમ-સુધી પણ પહેંચ્યી. અને આવી પાવક-જવાળામાંથી ઉંમા મેળવી અનેક હરિજનો પણ ચોતાના જીવનને વિકસાવવા લાગ્યા.

પાવનકારી પંદરખુર

ચોખામેળા નામનો એક વણુકર આ મહાન સંતમાળાના એક મણુકા જેવો હતો. એ લક્ષ્ણ તરીકે ઘણું ઊંચું માન પાસ્યો હતો. ઉપર જણ્ણાવેલી દક્ષિણમાં પ્રસરેલી ધાર્મિક અસરની ભરતીનો સૌથી મોટો જીવાળ ભીમા નહીના એક કિનારા પર આવેલા અતિ પ્રાચીન મંદિરની સાથે અથડાયો. આ મંદિર

તેરમા સૈકાની શરૂઆતમાં તો વિખ્યાતિમાં આઠું
નહોતું, પરંતુ ત્યાર પછીના સૈકાઓમાં મહારાજ્ઝની
જનતાની લક્ષ્ણિત અને એકનિધાની ભાવના પર આ
મંહિરે ખંડું જ મોટો લાગ લજોયો. છે. પંદરપુર-
માંની શ્રીવિઠોખાની ત્રિલંગ સૂર્તિનાં હર્ષન કરવાં
ને એની લક્ષ્ણિત કરવી, તે પ્રત્યેક મહારાજ્ઝીને-પછી
તે સંત હો કે સામાન્ય જન હો-જીવનનો એક
આણુમૂલ્યો પ્રસંગ લાગતો ને લાગે છે. જનસમાજના
હૃદયમાં એકનિધા, શ્રદ્ધાં અને લક્ષ્ણાની શ્રેષ્ઠ ભાવના
અને લાગણીએ પંદરપુરના આ વિઠોખાએ જગવેલી
છે. એની એવી કંઈક કંઈક કથાએ સમાજમાં
પ્રચલિત છે.

એક આપંગની લક્ષ્ણિતભાવના

પૈઠણુમાં એક લૂલો માણુસ હતો. તેને વિઠોખા
પર અત્યંત પ્રેમ ને લક્ષ્ણિત હતાં. તેના મનમાં
વિઠોખાનાં હર્ષન કરવાની પ્રણાળ વૃત્તિ જગ્યા. તેણે
આએ રસ્તો ઘસડાતાં ઘસડાતાં ધીમે ધીમે ચાલી
અનેક કુણો વેઠીને જે રીતે પસાર કર્યો, તે જેતાં
પણેખર આપણે આશ્રમભાં ગરકાવ થઈ જઈ એ
છીએ. આ મંહિર ખંડું કળાત્મક કે જાણ નથી,
તોપણું એના એક એક પથ્થરમાં અને પ્રત્યેક રજ-
કણુમાં ઘણું મહારાજ્ઝીય સંત-લક્ષ્ણોની લક્ષ્ણિત ને

એકનિધાની લાવના ને લાગણુંએ। એાતગ્રેત થયેલાં છે.

સંત દંપતીને પુત્ર-પ્રસાદી

ચોખામેળા વિઠોખાના આવા પરમ ભક્તોમાંને।
એક હતો. તેના ખાપનું નામ સુદામા હતું, માતું
નામ સુક્તાખાઈ હતું. તે ખણે પંદ્રપુર પાસેના
અનગોડ ગામમાં રહેતાં હતાં. ગામના પસાયતાની
અધી જમીન તો એમની હતી, ને બીજી રીતે
પણું તેએ સંસારમાં એમના દરજામાં સુખી હતાં.
છતાં. એમને કંઈ પણું સંતાન ન હોવાથી એમને
દિલગીરી રહ્યા કરતી. સુદામા વારંવાર પંદ્રપુર
ચાત્રા કરવા જતા. એક વાર તેમની ગેરહુંજરીમાં
કુઈ ઢેડની જમીનમાંથી ૨૦૦ કેરી લઈ એદારના
મુસલમાન સુખાને રાન્યભાગ તરીકે આપવા સુક્તા-
ખાઈ જતાં હતાં. થોડેક આઘે જતાં રહેતામાં એમને
એક અતિશય ભૂખ્યે. પ્રાણણું મળ્યે. એણે સુક્તા-
ખાઈ પાસે કેરીએ માંગી. ભૂખ્યે. જણી સુક્તાખાઈએ
તેને પાંચ કેરીએ આપી. પ્રાણણું તે ખાઈ ગયો.
તેને આશરીવાહ આપ્યા કે ‘તે’ મને પાંચ કેરી
આપી, માટે તને પાંચ સંતાન થશો. સૌથી મોટા
છાકરાનું નામ તું ‘ચોખા’ પાડજો; કારણું કે તારી
કેરી મેં ચાખી છે. ‘ચોખા’ અને ‘ચાખવા’

એ છે શાણ વરચે અર્થસંબંધ રહેલો છે. એ ભાષામાં (મરાઠી ભાષામાં) ‘ચાખવું’ એ માટેનો શાણ ‘ચાખા’ એ શાણની સાથે અર્થસંબંધ ધરાવે છે. આ શાણ હાલીને તે કથાંચે અદેશ્ય થઈ ગયો.

ખાળક ચાખાની સેવા

ત્યાર ખાદ સુકૃતાખાઈને એક છોકરો થયો. એનું નામ એમણે ‘ચોખામેળા’ કે ‘ચોખા’ પાહુંદું. ‘ચોખા’નાં માખાપ અતિશાચ પવિત્ર જીવન ગાળતાં હુતાં. એની અસર કુદરતી રીતે જ એના પર ખૂખ થઈ. છેક નાનપણુથી જ તે પ્રખુનું નામસ્મરણું કર્યા કરતો. પોતાના વાસને વાળીજૂડી તે સાઝે રાખતો. પોતાની કેામમાં ગંધા ને મેલા રહેતા હોય તેવા સાથીએને એકઠા કરી તેમને નાહવા લઈ જતો. તેમનાં ફાટેલાંતૂટેલાં ને મેલાં કપડાં ને શરીર સાઝે રખાવતો. થોડા જ વખતમાં આખા વાસનો ચોખામેળા પ્રાણું થઈ પડ્યો. ઉચ્ચ ગણ્યાતી કેામના હાથે પોતાના ભાઈલાંકુઓનું અપમાન થતું જોઈ, તેના હૃદયના તારેતાર હલમલી ઊઠતા અને તેથી તે વધારે ને વધારે શુદ્ધ અને સાત્ત્વિક થવા મથતો. પોતાની કેામનાં ખાળકેામાંથી પણ અનેક હુર્ગુણોનો નાશ કરવા તેમને તે સહુપદેશની વાતાંએ કહેતો, લજન ગવડાવતો, રાસ રમાડતો. કેટલીકવાર

હરિજન સુંતે!

સમાજનો અન્યાય ને જીવભ તે પોતાની કોમ પર
ગુજરતા જેતો ત્યારે સાવ અસહ્યાય ખની જઈ
પ્રભુને દીનલાવે પ્રાર્થના કરતો.

ઉરની અરજી

(એક જ હે ચિનગારી-એ ટાળ)

હે ! સુજ રંક જીવન-આધાર ! પ્રભુ તને ઉરના કોટિ પ્રણામ.

બાળક એકલવાયો પ્રભુ હું,
ઉર મુંઝાઉ છું ખૂબ;
સોડમાં એવાને હેતે લો કે હું,
નેથી પામું તુજ હું. હે સુજો

મનનો મનોરથ મનમાં શામશો,
વર્ષાવે નહિ જે રૂડેમ;
રંકતું જીવું અકારથ જાશો,
વીનતું, રેલવો ગ્રેમ. હે સુજો

કરુણાળ કરુણા કરી રંકના
કોડ પૂરજે ઓ તાત !

ગ્રેમે ઉરની અરજી પાંદતું,
ધ્યાને લેજે સુજ વાત. હે સુજો

જેલું તેલું ઘર તાથ છે હાસનું,
જાણુને કરજે વાસ;

દ્યા દામોદર દિલમાં દાખલી,
અપણે ઉર વિલાસ. હે સુજો

કાલાવાલા કરી પાલન પાથરં,
લળીલળી લાગું હું પાય;
અખંડ આનંદ ઉરમાં રૂકે એવું,
સુખ હેઠે વિલુરાય. રે સુજો
સિમત કરી એક વાર ને નીરાયો,
ગ્રામે લઈ શિશુ અંક;
ન્યોળાવર કરું લાયો જીવન હું,
ધન્ય ધન્ય થાઉં રંક. રે સુજો
પ્રાર્થના કરતાં દિલથી સુજને.
આવડે જરા ન બાપ !
ગાંકુંબેલું રહું તુજ આગળ હું,
દાસ. ચરણનો આપ. રે સુજો

(શિખરિણી)

ભલે છાને આવો વિપરિત ઉપાધિ અમ શિરે,
ભલે છાને હોયે વિપરિત પરિસ્થિતિ અમને;
અધુંયે એણંગી જઈશ હું. હૃપાંધી તુજ પ્રલુ !
અતાં માગું, ‘હેલે ધીરજ, અળ, તાકાત, દિલ તું.’

પુડચા! ઉપર ખાડુ

જન્મથી જ વવાયેલા એના હૃદયમાંના ભક્તિના
સંસ્કાર હુવે તો ધીમે ધીમે અંકુરિત થવા લાગ્યા.
ગામભાંથી મરૈલાં ઢારને એંચી લાવવાં, એતી કરવી,
સરકારની ને ગામની વેઠ કરવી—એ એની કોમનાં

કામ ગણ્યાતાં. એક વખત એવું બન્ધું કે પોતાના વાસમાંથી કંઈ કામપ્રસંગે ઘણ્યાખરા લોકો પરગામ ગયેલા. તે સમયે ગામમાં એક મરી ગયેલું ઢોર આપણું ચોખા—મેળાને જ ઉપાડવા જવાનું બન્ધું. પોતાના એકલાને માટે આ કામ બની શકે તેવું ન હતું. ટોળે મળેલા લોકમાંથી કોઈકે કહ્યું, ‘આઈ ખાઈને ઝાલ્યો છે તો મોટો તગડા જોવો. મોટા પાડા જેવું તો શરીર છે, ને પછી જેંચાતું કેમ નથી? તમારી જાત જ ખાસડાને લાયક છે. તે વિના તમે પાંસરા થાઓ જ નહિ.’

આ શરીરો સાંભળીને ચોખામેળાના હૃદયને સખત આધાત લાગ્યો. તે એક રાજ્ય પણ એલી શક્યો નહિ. ભરેલે હૈયે નાનું ભાવ પ્રકટાવી તેણે પ્રભુને પ્રાર્થના કરી કે ‘હે કૃપાસિંહુ! કરુણાળુ! દ્વારાસાગર! પતિતપાવન! પતિતોદ્વારક! શરણાગત-વત્સલ! હે પ્રભુ! મેં શાંયે પાપ કર્યાં હશે કે મારે આવી અપમાનિત જિંદગી ગાળવી પડે છે! આ લોકો કેમ દેખતા નહિ હોય કે આ કામ મારા જોવા એકલાથી બની શકે એમ નથી! શું તેમને બુદ્ધિ નહિ હોય? તેમને હૃદય નહિ હોય? શું તેમને લાગણી નહિ હોય?’

હેજે ભલા ! કંઈ અખર તું (હરિગિત)

હે તાત ! એવા બાળની હેજે ભલા ! કંઈ અખર તું. (૨૫)
દિલમાં થતી મુંજવણું બધી તુજ વીણુ કોને હું કશું ?
જેમાં ગણે તેમાં મને છે એકલો ને એક તું. હે તાત !
ચરણુકમળો તાહરે દિલની વરાળો કાઢું હું,
નિત્યનું એ કામ સુજ તુજને પ્રભુ ! સુણાવવું. હે તાત !
છાને ભલે ના સાંભળો, અમીદણ્ણ છા ના તું કરે,
તાયે ન છાડાશે હુંથી આગોટવાનું તુજ પહે. હે તાત !
છા હાસ્ય તું નવ કેરતો, પણું લાત મારે જો કદા,
તાયે કરીશ ગ્રેમે સમર્યાં તુજ નામ ઘારું દિલમાં. હે તાત !

પ્રભુ ! પાને પડેલાને (ગંગલ)

પ્રભુ ! પાને પડેલાને હૃદય તુજ આશરો હેજે. (૨૫)
અતિશાય ભાર એજથી લહાયેલો શિરે, બાપુ !
ભરાતું એક ડગ પણ ના, પણીથી પંથ શેં કાપું ? પ્રભુ !
કશું ચાલ્યા બહુયે ચેં, કપાયો પંથ તાયે ના,
જવાનું કેટલે આંદે નજર માર્ઝી પડેંચે ના. પ્રભુ !
છતાં પડતો, લથડતો ને હું તો આગોટતો આવ્યો,
અરે ! ત્યાં દૂર કાં ભાગી નકામો તેં મને તાવ્યો. પ્રભુ !
ચઢેલો થાક ચુગચુગનો પ્રભુ ! પાયે પડેલો હું,
ઉતારીને થવા હળવો શરણ તારે ટળેલો હું. પ્રભુ !

પ્રભુ ! કાં કૂરતા આવી ! રમે શા જેલ આવા તું !
 અહીં તો જીવ રૂકેંસાયે અને મન હાંસી તારે શું ! પ્રભુ !
 પણવવાનું તને ગમતું સતાવી લે ખૂરો સુજને,
 પરંતુ તું ધીમે ધીમે પ્રજલ્યા ના કરીશ સુજને. પ્રભુ !
 હૃદયની વેદના બાંડી બતાવું કો સમીપ જઈ હું ?
 બતાવાનું હતું નેને, ફરી કાં પીડ એડો તું ? પ્રભુ !
 નસેનસ, રોમરોમે, શી પીડા પ્રસરેલ છે આપુ !
 વ્યથાની હોળી પ્રકટી છે મને કાં માપતો આતું ! પ્રભુ !
 કસોટીમાં પ્રભુ ! તારી ઉત્તરવા શક્તિ ના મારી,
 કરુણા ને કૃપા માયા કરું હું તો સહા તારી. પ્રભુ !
 આવી આવી પ્રાર્થનાઓ તે લગવાનને કરતો.
 શ્રીપ્રભુતું પ્રાર્થનાલાવે રમરણ કરી ફરીથી તેણે
 ઢાર જેંચવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ તેમાં તે
 કોઠ્યો નહિ.

કૃષ્ણ લાગણી પર જિદ્દ્ય ગાણો

ટોળામાંથી કોઈ કે કહ્યું, ‘સા....લા ! તારા
 ખીજ અધા લોકો કથાં મરી ગયા છે ? તમારાં હૈરાં,
 છોકરાં, અધાને હોલાવી લાવો ને અહીંથી ઢાર
 જેંચી જાઓ. જેતો નથી કે આ ફરિયામાં ગંધ
 ગંધ ફેલાઈ રહેલી છે !’ ચોગ્યામેળાના દિલમાં
 લાગણીનો જે દરિયો જાણગી રહેલો હતો, તે જાણ-
 વાની કે સમજવાની કોઈ ને પડી જ ન હતી.

એમને તો એટલું જ જોઈતું હતું કે ગમે તે રીતે ને
ગમે તે લોગે એ ઢાર ત્યાંથી ફર થલું જ જોઈએ.

પ્રલુદૃપાનો ચસ્તકાર

ચોખામેળાથી આ અપમાન સહુન થઈ શક્યું
નહિ. એણે પ્રલુને પ્રાર્થના કરી. પોતાના બધાય
ખળનો ઉપયોગ કરી, આંખો ભીંચી, ઝરી પ્રયત્ન
કરવા માંડ્યો. કોઈ ચમતકારિક હૈવી ખળનો જુસ્સો
તેનામાં પ્રકટ્યો. તેની આંખ ને તેનું મોં રાતાં-
ચોળ ખની ગયાં. શરીરની નસો ઊપર્સી, તરી
આવી. આખરે તે મરેલા ઢારને ખડ્ધાર જેંચીને
લઈ ગયો. આ ખનાવથી આખા ગામના લોકો
ખરેખર નવાઈ પાસ્યા. તેમના હિલમાં ચોખામેળા
માટે માનની લાગણી ઉત્પજ થઈ. કારણ કે તે
મરેલા ઢારને એકલા જેંચી લઈ જવું એ મનુષ્ય-
શક્તિના ગજ ઉપરાંતનું કામ હતું, એ તો દરેક
જણને સ્પષ્ટ લાગ્યું હતું. તેથી ગામલોકને નિશ્ચય-
થી લાગ્યું કે જરૂર ચોખામેળાને કોઈક હૈવી ખળે
મદદ કરેલી લાગે છે.

ઉત્કટ, ઉન્મત્ત લક્ષ્ણ

ચોખામેળા હવે તો ખૂબ એકાયતા ને એક-
નિષ્ઠાથી જ્ઞાનલક્ષ્ણપૂર્વક પોતાની સાધના કરવા
લાગ્યો. સાધુસંતો પાસે જઈ પોતાની મુર્કેલીએનું

તે નિરાકરણું કરી લેતો. ભજનમંડળીએઓમાં ભગતો ને જ્યારે તે ભજન કરતો, ત્યારે ખૂબિ લાવાવેશમાં આવી જતો. કેટલોક વાર તો તે હૈથાક્ષાટ રહતો.

હૃદયમાં જો ધરે મુજને

(ગઝલ)

હૃદયમાં જો ધરે મુજને બધે તુજ સહાય તો તો છે. (૨૫) ગમે તેવા ભલે છોને હૃદયમાં ધા પડે ભારે, સહેવા સર્જું હું જિલ્લો. પ્રતાંગે ગ્રેમને તારે. હૃદયમાંઠ અકથ બળ ગ્રેમમાં તારા ન જેનો સામનો કોથી થાઈ શકશો જગો, બાપુ ! રહ્યો નિશ્ચિંત હું તથી. હૃદયમાંઠ પ્રલો ! તુજ ગ્રેમ જેંચે છે સદ્ગત તારા પ્રતિ મુજને, હવે તાકાત કોની છે મને પથ રોકી શકવાને ! હૃદયમાંઠ જિલ્લેલા પહાડ છો પથમાં હૃદય નવજ્ઞેમ સ્કુલું છે, જાડી એળંગવાને તે હવાં હિંમત પૂરી રૂકે છે. હૃદયમાંઠ કૃપા જો માત્ર તારી હો, બીજાંને પ્રકોંચા વળવાને, પડીશ પૂરો હું તો બાપુ ! હૃદય જો તું ધરે મુજને. હૃદયમાંઠ

આજનો ચોકાર

(કાઢી)

બાળ તને ચોકારે રે, રૂકેને મારી રહાયે ગલુ ! (૨૫) ઘૂંટણુંયે જ્યાં શાખાંયો ચાલવા, પડતો આખડતો હું તાત ! પથે વાગતાં મને કદી હું, જેઓ હું તારી ભણી, નાથ ! આશરો બાળને માનો રે, એવો મારે તું એક ગલુ ! બાળઠ

મનમાં હૈંશ ધર્ણી છે સુજને, પુડેંચી જવાને સુજ હામ,
સંગી બાધક મળિયા સુજને, બનાવે મને તે ઐક્ષામ;
અથડાની મારે સુજને રે, બતાવી ગ્રલુ ! રાહ ઊંધો. બાળો
જ્યાં જ્યાં બાળનું મન લોભાયે, તોથે ધરું તુજમાં ત્યાં ચિત,
નિત્ય નવી મથામળુ થાતાં થોલી વિચારું નવી રીત;
જ્યાં ત્યાં એમ કરીને રે, ભરું છું ડગ ધીમે પ્રલો ! બાળો
થાડ્યો જતાં વિચારો લડું હું, સંગ્રહું નવું બળ, તાત !
'છેક ગળિયો થઈ ઐસી જવાતાં, ચલાવશે અહી સુજ હાથ'
ભરોંસો એવો ઊડો રે, હૈયે મારે તારો પ્રલુ ! બાળો

આવું આવું શ્રીલગ્વાનને વારંવાર તે પોકા-
રતો. ખાવાપીવાનું પણુ તેને ગમતું નહિ. કેટલીક
વાર આખા ગામમાં તે નાચતો, ઝૂદ્ધતો ને ઝર્યો
કરતો. ગામને પાછે ઝરતાં ઝરતાં આવતા સાધુ-
સંતોનાં ઝુંડમાં તે જતો ને જિશાસુલાવે ચર્ચા કરતો.

આંતે તો સંત તરશે જ

પહેલાં તો ગામના લોકોએ તેની ખૂખ અવ-
ગણુના કરેલી, તિરસ્કાર કરેલો, અપમાન કરેલું ને
કોઈ વાર મારેલો પણ ખરો. પરંતુ હવે એની
સાત્ત્વિક ખુદ્ધિ, ગ્રલુ પ્રત્યેની તેની એકનિષ્ઠા અને
એની દદ અક્ષિત જોઈને લોકોનું એની પ્રત્યેનું
વલણુ ખદલાયું.

વિઠોખાને છુટે આર્થના

એ ઘણી વાર પંદ્રબુર જાતો ત્યારે ખંડારના
દરવાજે ભાલો રહી પ્રલુની નાભાવે પ્રાર્થના કરતો કે :-

(વસંતતિલક)

પાપી, પતિત અધમાધમ હોય ગ્રબે,
અદ્ધારી જે પણ તને ઉર સેવશે જે;
પામે પરાગાતિ નકી શુતિવાક્ય તારું,
એવા પ્રલુ ! હુદ્ધયથી તુજને નમું હું.
પાપી અને મલિન ઉર અનન્યભાવે
તારું કરે સ્તવન જે પ્રલુ ! નિત્ય તેને
સાંધુ બનાવી ઉર હુંચું કે ન રાખું,
એવા પ્રલુ ! હુદ્ધયથી તુજને નમું હું.

(શિખરિણી)

અતાવું કાને તે સુજ જિગારનું દર્દ હું જાંકું ?
હિલાસો હેનારું પ્રલુ ! નવ મળો તું વિણુ બીજું;
તને પોતાનો મેં ગાળી, હિલ અતાચું સુજ બધું,
ધરે હાવાં તુંચે પણ ન પરવા મારી કંઈ શું ?
પ્રલુ ! સંધ્યા વળા ન્યહિં ત્યહિંથી પક્ષીગણું બધાં
ભડીને આવે છે નિજ સ્થળ પરે હામ દરવા;
ભલે સૌ દ્વિદ્યો ત્યમ સુજ જતી કર્મ મહીં છો,
કૃપા હે કે સાથે સતત વળી તે હામ પર હો.

અરે ! આ સંનેહો જીવન વિકલ્પાવા ન સુજ હે,
રહ્યો છે શું જોઈ ? બધું ધૂળ કથું—કારણું થશે;
હશે જે તારામાં પદ—કમળ અદ્ધા દદ્પણે,
ભિલા વર્ચચે પુહુડો દૂર ખસી જશે માગું દઈને.
અભિલાષા—અભિન્ન સુજ હૃદય બાળ્યા નિત કરે,
અને સાથે ડાડો સુજ હિલ અસંતોષ સુજને;
હતાં શો ! અચે તે જીવન મહિં ઉન્માદ્ક નિશો !
જીવું તે આધારે, હું—ગર કરુણા તાત કરજો.

(વસંતતિલક)

અહાંડ આ સકળનો જ્યાહિં તું વિધાતા;
તો માગુંદશું પ્રભુ ! સુજ રાંકનો થા,
ભૂલો પડ્યો વિકટ આ વનમાં પ્રભુ : હું
ન્યાં ત્યાં કરું હું રખડયા, કર પાર બાપુ !

હૃદયલી જીવનાની અસર

અનુમ પ્રાર્થના કરતાં કરતાં અસ્થલિત આંસુ.
નો પ્રવાહ વહેતો. પોતાની પાસે હોલાવી લેવાને
હૃદયથી તે વારંવાર અભુને વનંતી કરતો. લોડો તેની
ભક્તિનો વેગ જોઈ તેના પર જાવ રાખતા ને ઘણ્ણા
તો તેની સાથે ડાઢતાણેસતા પણ થયા ખરા. કેટ-
લાક ‘ઉર્ચ્ચ વર્ણના’ શેના શિષ્ય પણ થયેલા
હતા. ઈશ્વર એને પ્રત્યક્ષ છે એવી એક ઉર્ચ્ચ
વર્ણની કુમારિકાને હિલમાં દફ પ્રતીતિ થઈ જવાથી

તે જઈને ચોખામેળાને પગે પડી ને પોતાને તેની પતની તરીકે સ્વીકારવાને કાલાવાલા કરવા લાગ્યી. આથી તુરત ચોખામેળાએ પોતાનું વતન ત્યાજ્યું.

દર્શાનની ઉત્કૃષ્ટ ઝંપુના

પ્રભુની નળુકમાં નળુક રહેવાથી ઓટલા ખાતર તે પંદ્રબુર રહેવા ગયો. પોતે મહાર હોવાથી મંહિરમાં પ્રવેશ કરવો તે તેના સારુ તે જમાનામાં શક્ય નહોતું. તેમ છતાં તે ખંડારના દરવાજેથી પ્રભુની પ્રાર્થના કર્યા જ કરતો હતો. કેટલીક વાર તો કલાકેના કલાક સુધી ત્યાં જ પોતે જાણો રહેતો. કોઈક વાર હૃદયના ઉનમત્ત લાવથી નાચી જઈતો, તો કોઈક વાર રડતો, તો કોઈક વાર ગાંડાની માઝુક ખકવાદ પણ કરતો. પોતાને પ્રભુની પવિત્ર મૂર્તિનાં દર્શાન થઈ શકતાં નથી, તેથી કોઈ પણ રીતે તે મેળવવાં એમ વિચારી તેણું કેટલુંક સેનાનું કામ ઉપાડી લીધું. મંહિરના ખધા રસ્તા તે પોતે વાળતો, કચરોપૂંને ફૂર નાખી આવતો. મંહિરની આસપાસની ખધી જ જગા તે અત્યંત સારુ રાખતો. પ્રત્યેક પળ તે પ્રભુના ધ્યાનમાં તહ્વીન રહ્યા કરતો. આમ પ્રાર્થનામાં ને ભક્તિના લાવમાં અને પ્રભુપ્રીત્યર્થના સતત એકધારા કર્મામાં તે પોતાના હિવસ વ્યતીત કરતો હતો.

લોકેની હેરાનગતિ

પણ એક નીચ મહાર આવો પરમ પ્રભુલકૃત
અને—હોય, એવો વિચાર પણ તે સમયના પ્રાદ્ધાણુ,
વિક્રાન પંડિત, અને વૈષણવ સમુદ્ધાયને સહ્ય ન
લાગ્યો. તેઓ ચોખામેળાની ખૂખુ હાડછેડ કરતા.
તેઓ એને પજવતા. કેટલાક તો તે જ્યારે બહાર-
ના દરવાજે ઊભો રહ્યો એકલાવે એકાચ્ચપણે તહ્વીન
હોય, લ્યારે તેના તરફ કાંકરા નાખવાનું પણ ચૂકતા
નહિ. એક સમયે ચોખામેળા શ્રીવિઠોખાની ગદ્ગાદ
કંઠે પ્રાર્થના કરતો હતો કે :—

(શિખરિણી)

ગરીએ પિલાયે ધનિક જનના ત્રાસથી જગો,
અમાર્થાને ખાવા પૂરતું પણ કેં ધાન ન મળો;
પ્રપંચી ઝાવે છે, ભગતજન તારા રડવડે,
ઊધો બાળ એવી તુજ નીરખી આશ્ર્ય ઊપન્ને.

કાગડાની કોટે હીરો ન શોલે

આવા કંઈક હૃદયના ભાવથી તે પ્રાર્થના
કરતો હતો, ત્યારે એક પ્રાદ્ધાણુ તિરસ્કારથી કહ્યું,
'તારી લક્ષ્ણ-સાધનાનો કશો અથ્ય નથી. તું
દ્વિવસ અને રાત પ્રભુનું લજન કર્યા કરે છે, પણ
પ્રભુની પવિત્ર મૂર્તિનાં દર્શાન કરવા માટે તું તર્દન
અયોધ્ય છે. કાગડાની કોટે તે વળી હીરો શોલે ?

તું તો પતિત અને અસપૃશ્ય છે. તને આવેા અધિકાર કોણે આપ્યો ?' આવી રીતે ચોખામેળાને ઘણું લોકો મહેણું મારતા.

જ્યારે ચોખામેળાથી સહુન ન થતું, ત્યારે જાવથી પ્રણામ કરી જવાખ વાળતો કે, 'સૂર્યસુખી કમળ સૂર્યથી કરોડો ગાઉ હુર છે, તો પણ સૂર્ય પોતાનાં કિરણો એના પર ફેંકી પોતાની ભમતા દર્શાવે છે. સૂર્ય પોતાનો પ્રકાશ આપવામાં નથી જોતો પારસમણું કે નથી જોતો એક ઠીકરી. એને મન આ હુનિયાના લેદબાવ નથી. તેવી રીતે પરમ કૃપાળુ પ્રભુ મારી સંભાળ રાખશે અને જરૂર મારી પ્રાર્થના સંભળશે. તમે મને ગમે તેવો નીચ ગણો છતાં જો મારું મન પ્રભુમય હુશો, તો હું પ્રભુના મંહિરની આંદર બ્લું છું. એને ગમે તેવો ઉચ્ચ વણુંનો માનવી જીવને શ્રીમંત હોય કે પ્રતિષ્ઠિત હોય, પણ જો તેનું મન જગતના પ્રપંચેમાં રમ્યા કરતું હુશો, તો તે પ્રભુ-મંહિરની આંદર હોવા છતાં પણ સાચી રીતે પ્રભુ-મંહિરથી કરોડો ગાઉ હુર છે.'

ભૂગવાને હાથ ઝડદ્યો।

એક રાતે એવું બન્ધું કે જીણે વિઠાખા પોતે એની જૂંપડીએ આવ્યા. એને મંહિરના ગર્ભદ્વારમાં

લઈ ગયા. ચોખુંમેળાને હાથ પોતાના હાથમાં
લઈને વિઠોખાએ કહ્યું કે ‘તારી લક્ષ્ણથી હું પ્રસ્તર
થયો છું. તું કોઈ વાતે ઉદ્દેશ પામતો નહિં.’
એટલામાં મંહિરનો એક પૂજારી બહુર સૂતો હતો,
તે જાગી ઉઠ્યો. તેણે ચોખુંમેળાને મૂર્તિ પાસે
છાડેલો જોઈ, એવીજ પૂજારીએને ખૂમું પાડી, ‘અરે !
દોડો, દોડો ! આ ચોખુંમેળા તો શ્રીવિઠોખાની
મૂર્તિ પાસે જઈને જોડો છે ! એ લુચ્ચો, એઠમાસ
મહુર દરવાજે તાળાં હીધેલાં હોવા છતાં ગમે તેવી
રીતે લુચ્ચાઈથી મંહિરમાં હાખલ થઈ ગયો છે.
પ્રભુમંહિરને તેણે અપવિત્ર કર્યું છે. અરેરે ! તે
કુણ્ઠે ધર્મનો નાશ કર્યો. પવિત્ર ખાલ્સાણે એણે
અલડાવ્યા.’ ખાલ્સાણે તો કોધથી ધૂંઆપુંથા થઈ
ગયા. તેમણે ચોખુંમેળાને પકડ્યો ને દરવાજી બહુર
ઝેંકી હીધે ને કહ્યું, ‘જ ! અહીંથી લાગી જ.’
ચોખુંમેળાએ ધીમેથી હુસીને કહ્યું કે, ‘અરે
મહુરપુરુષો, તમે નકાસા રા માટે ધાંધલ કરો છો ?
ધર્મ તે એમ કોઈનાથી નાશ કર્યો શું નાશ થઈ
જતો હુશો કે ? એક મહુરે ગંગાલુમાં સંનાન કર્યું
તો શું ગંગાલુ અપવિત્ર થઈ જશો કે ? એક
હરિજનના શ્વાસથી સ્પર્શ થયેલો, કુંકાતો પવન
શું આખા ગામને અપવિત્ર કરી શકે ખરે કે ?
પ્રભુને મન ઉચ્ચય કે નીચ, લણેલા કે અલાણ,

સારા કે એટા, એવા કશાય લેહ નથી. જેકે તમારી નજરે હું નીચ છું, તો પણ મેં પરમ કૃપાળું પ્રભુનો કંઈ પણ ગુનો કર્યો નથી; તેથી તેની નજરે નીચ નથી. આપ જેવા પવિત્ર વિક્રાન પુરુષોને આવી અર્થલીલ ભાષા હોલવી છાજતી નથી. ’

મંદિરનો પૂજારી કોધથી રાતીચોળ આંખ કરી અરાડી ઊઠ્યો કે, ‘ અરે મૂળું ! ચૂપ કર. શું એક મહાર ખાસગુણોને ઉપરેશ આપશો ? નીચામાં નીચી જાતનો એક તુચ્છ, અપવિત્ર મનુષ્ય શું તું ખાસગુણોને સમજાવવા હેઠો છે ? અરે, જ લુચ્યા ! શું અમે તારું બધું સાંભળ્યા કરીશું ? ’

પૂજારીએની ફરિયાદ

ખાધા પૂજારી એકત્ર થઈને ગામના પંડિતો સાથે ગામના સુસ્તિલમ સૂખા પાસે ગયા, અને ‘ ચોખામેળાએ મંદિર અલડાયું ’ તેવી ફરિયાદ કરી. સૂખાએ તેને હોલાવી મંગાયો. અને પૂછ્યું કે, ‘ તું તો એક નીચ જાતનો છો. મંદિરમાં તો પ્રવેશ જ કેમ કર્યો ? ’ ચોખામેળાએ જવાખ આપ્યો કે, ‘ વિઠોખા જાતે જ મને અંદર લઈ ગયા હતા. તેમાં હું શું કરું ? હું તો એક અતિ પામર, તુચ્છ જીવ છું, એવું વારંવાર મેં શ્રીપ્રભુને કહ્યા કરેલું છે.

પ્રભુને દર્શાન હેવા કાજે મેં મારી જિંદગી, મારું સર્વસ્વ એના ચરણુકમળમાં કથારતુંયે સર્વપણું કરી દીધું છે. એને દર્શાન હેવા કાજે એની સતત આર્થાના હૃહયમાં હૃહયથી મેં કર્યા કરેલી છે. રાત્રિની રાત્રિએ રડી રડીને તે કાજે વિતાવેલી છે ને હવે જ્યારે પરમ કૃપાળું પ્રભુએ મારા જેવા એક પામર ઉપર કૃપા કરી છે, લારે તમે લોકો ‘મેં મંહિર અપવિત્ર કર્યું છે,’ એવો આરોપ મૂકો છો ! તો હવે નઅતાપૂર્વક આપને વિનતિ કરું છું કે આપને ચોંધ લાગે તેમ કરશો.’

નિર્દ્દીય સજ્જ

પરંતુ તે મુસ્લિમ સુણાએ તેનું કંઈજ સાંસાજ્યં નહિ. તેને એક વળી સાથે ખંધાવ્યો. અને મહોદ્ધા-એમાંથી ઘસડાવ્યો. અને આખરે ખહાર ફેંકી દેવડાવ્યો. આ ખંધું જ કુઃખ ચોખામેળાએ કંઈ પણું રાગદ્રોષ વિના અત્યંત ગ્રેમપૂર્વક સહન કર્યું. આવી રીતે તેને સજ્જ કરીને પંદ્રપુર ખહાર ધક્કેલી દીધો. પંદ્રપુરમાં પ્રવેશ કરવાની તેને મના કરવામાં આવી. એવી રીતે તેને ભીમા નહીની ચેલે પાર રહેવાની કેરજ પાડવામાં આવી.

હૃદયની ભક્તિ ને ઉદારતા

આમ અપમાનિત અને તિરસ્કૃત થયેલા

ચોગામેળા હવે શ્રીવિઠોણાના મંહિર પાસે જઈ શકતા ન હતા. છતાં તેના મનોમંહિરમાંથી એક ક્ષણું પણું શ્રીવિઠોણા ખસ્યા ન હતા. હું સેશાં તે પોતાનો બંધો સમય આત્મચિંત્વનસાં જ ગાળતા. લોકોએ આટઆટલા તેમને હેરાન કરેલા હોવા છતાં લોકો પરતવે તેમના દિલમાં જરા પણું રૈષ ન હતો. બધું પોતે ગ્રેમપૂર્વક સહન કરી લેતા.

ચિઠોણા જીતે પુદ્ધાર્યો

ભીમા નહીના ડિનારા પર તેમણે એક હીપ-માળા ખંધાવી. આજે પણું તે હુયાત છે. એક હિંસ તે લિંણોળીના (લીમડાના) જાડ નીચે જમતા હતા, ત્યારે સુંહર વઙ્ગાભૂપણુથી સજજ થયેલા શ્રીવિઠોણા પોતે તેની પાસે પદ્ધાર્યો. તેની સાથે ગ્રેમથી લોજન કરવા લાગ્યા. ચોગામેળાની પતની દહીં લાવી હતી, તે તેણે પ્રભુને પીરસ્યું. પીરસતી વખતે શ્રીવિઠોણાના પીતાંણર ઉપર કેટલાક છાંટો પડ્યા; આથી ચોગામેળાએ પોતાની પતનીને ધમકાવી કે ‘જ્યારે શ્રીપ્રભુ પોતે કૃપા કરી આપણી સાથે જમવા પદ્ધાર્યો છે, ત્યારે તું કેવી હોકાળજ રાખે છે?’

ઓછાણું પૂજારીનો કોધ

અરાણર આ જ સમયે એક ઓછાણું પૂજારી તે રસ્તે થઈને જતો હતો, તેણે આ શાફ્ફો સાંલાંયા.

તેને આથી ઘણો કોધ ચલ્યો અને આ દુષ્પ મહાર
પ્રલુની નિંદા કરી રહ્યો છે, એમ જણી તે એકદમ એના
પર ધસી ગાંયો. ઓખામેળા અટકાવી શકે તે
પહેલાં તો તેણે શ્રીવિઠોખાને જેરથી એક સુઙ્કો
લગાવી દીધો. લાર પછીથી તે પાસેની નહીમાં જઈને
નાહ્યો અને શ્રીવિઠોખાના મંહિરમાં દર્શાન કરવાને
ગયો. પરંતુ જેવો તે પ્રલુની પ્રાર્થના કરવા લાગ્યો.
કે તુરત તેની નજર પ્રલુના સુંદર રેશમી પીતાંખર
પર પડી. ત્યાં દહીંના ડાઘા પડેલા દીઠા. શ્રીવિઠોખાનો
એક ગાલ ઝૂલી ગયો હતો. આંખમાંથી અશ્રુધારા
વહી રહી હતી.

પશ્ચાત્તાપ

ચેલા પ્રાહ્મણે આ જેચું ને જણયું. તેના હૃદયમાં
ભાવનો સંચાર થયો. હવે તેને સમજચું કે તેણે કે
સાધુને માર્યા હતા એ તો સાક્ષાત્ શ્રીવિઠોખા જ હતા.
'અરેરે ! મેં મૂર્ખ મારી જતનું સત્યાનાશ વાજયું !
માતી પર જેમ હથોડો પડે, તેમ હું તેમના પર
તૂટી પડ્યો હતો. અરેરે, પ્રલુ ! મારા જતીય અલિ-
માને મને ભુલાયો. મેં મારો સર્વનાશ જાતે જ
નોતયો છે. પ્રલુ ! દ્વા કરો, કૃપા કરો.'

શ્રીવિઠોખાની પ્રસંગતા

પોતાનું અલિમાન ગળી ગયું. નાનામાં નાના

અની પોતાની જતને તે ધિક્કારવા લાગ્યો. ઉત્કટમાં ઉત્કટ પત્રીસ્તાપની લાગણીમાં ઝૂણેલો તેવો તે ખાદ્યાણું ભીમા નહીની પેલે પાર ગયો, અને તે સાધુ પુરુષની માણી માણી. અત્યંત કાલાવાલા કરવા લાગ્યો. અને તે સાધુ પુરુષને મંહિરમાં તેડી લાગ્યો. મંહિરમાં આવીને જ્યાં જુણે છે તો અતિ આશ્વર્ય સાથે તેને જણાયું કે ઈજા પામેલો ગાલ હુંચે તો સાંજે થઈ ગયેલો છે. આ સાધુ પુરુષને જેતાં જ શ્રીવિઠોણા પોતે જ આનંદ પાસ્યા હોય, તેથું સિમત તેમના મોં પર ફરકયું.

હાડકામાંથી એલાનું નામસરણું

ચોખામેળાનું મૃત્યુ ખડુ કરુણાજનક છે. હોદારના સુસલમાન સૂખાએ પોતાના પ્રાંતના અધા મહારોને હુકમ કર્યો કે મંગળવેઢા ગામને ફરતો કોઈ તેમણે ખાંધી આપવો. ચોખામેળાને પણું બીજાં અધાંની સાથે જવું પડ્યું. કામ પૂરું થવા આંધું તેવામાં એક ખાળુની અધૂરી રહેલી દીવાલ તૂટી પડી. કેટલાયે મહારો દણાઈ ગયા. એમાં આપણા સંતશિરોમણિ શ્રીચોખામેળા પણું હતા. ઘણું વર્ષો સુધી એ પડેલી દીવાલની નીચે એમનાં હાડકાં દટાયેલાં રહ્યાં. પરંતુ તેમના મૃત્યુ પછી પરમ સંતશિરોમણિ તરીકેની તેમની કીર્તિ ખૂબ વધી.

શ્રીનામહેવ નામના દરજ સંતને પ્રભુની પ્રેરણું મળી
કે તેણે ચોખામેળાનાં અસ્થિ પંદ્રપુર લાવવાં.
શ્રીનામહેવ પંદ્રપુર ગયા. પરંતુ ચોખામેળાનાં
અસ્થિ ખધાંની સાથે લેળસેળ થઈ ગયેલાં હતાં.
એકલાં તેમનાં હાડકાં નોખાં તારવી કાઢવાં એ તો
મુરુકેલ કામ હતું. આખરે શ્રીનામહેવે જમીન સાથે
કાન માંડીને સાંલજયું તો, એમ કહેવાય છે કે, એક
જગાએથી તેણે ‘વિઠોખા, વિઠોખા’ એવું નામસ્મરણ
થતું સાંલજયું, તેથી તેણે જણ્યું કે ત્યાં પડેલાં
તેવાં અસ્થિ ચોખામેળાનાં જ હોવાં જોઈએ. હૃદયની
અત્યંત આદરભક્તિથી એ અસ્થિ તેમણે લેગાં
કર્યાં. એમણે એને પંદ્રપુર આણથાં. ત્યાં એને
જમીનમાં હાટી એના પર ખાંસી ઘનાવડાવી. આજે
પણ તે જગા ત્યાં જણ્ણાય છે. લાં આગળ આજે
પણ હરિજનો ઊલા રહી શ્રીવિઠોખાનાં દર્શાન અને
પૂજન કરે છે. (જેકે હવે તો તે શ્રીવિઠોખાનું મંદિર
દરેક હરિજનને દર્શાન કરવાને કાજે ખુલ્લું સુકા-
ચેલું છે.)

ॐ હરિહાસ

ખંગાળમાં ધાર્મિક જગૃતિ

ઉત્તર અને દક્ષિણ હિંદની માર્ક તે મહાન ધાર્મિક પરિવર્તનનાં મોઢાંની અસર ખંગાળમાં પણ થયા વિના રહી નહોટી. પ્રેમ અને ઉત્કટ ભક્તિના સૂરો હેંલથ્યાં અને લાગણીવાળાં લાવાતમક કાંયો કારા સંભળાવા લાગ્યા. જથું હેવ કવિએ શ્રીરાધાકૃષ્ણની અદ્ભુત આધ્યાત્મિક પ્રેમની કથની ગીતગોવિંદના કાંયમાં ગૂંથી. એ કાંયો જનસમાજના હૃદયમાં ઊંડું સ્થાન મેળ્યું. સુષુપ્તિમાં પડી રહેલા સાત્ત્વિક પ્રેમના ખીજને આ કુરિત થવામાં એણે પ્રેરણા આપી. ચંડીહાસ વગેરેએ પણ એમાંથી પ્રેરણા મેળવી અને શ્રીકૃષ્ણના ઉત્કટ પ્રેમનાં કાંયો રચ્યાં. જનતાના હૃદય પર તેથી પ્રેમ અને ભક્તિનાં ખીજ રોપાયાં. શ્રી રામાનુજ અને માધવાચાર્યના સહુપદેશથી રંગાચેલા વૈણવ સાધુએ દક્ષિણમાંથી ખંગાળમાં આવીને પસ્યા હતા. કવિએનાં પ્રેમભક્તિનાં કાંયોથી અને ભજનોથી તથા આ વૈણવ સાધુએના સતત પ્રચારથી ભક્તિભાવના, ખંધુલાવના સારાયે ખંગાળમાં ફેલાયાં. લોકોના મનમાંથી રાગદ્રેષ, જાતિસેન્ટું જેર એછું

થયું. જનતાના દરેક વર્ગમાંથી પ્રલુના લક્ષ્ણો અને લોક્કવિ ઉદ્ભાવ્યા.

શ્રીચૈતન્ય મહાપ્રલુનું પ્રાકૃટચ

નહિયામાં શ્રીકૃષ્ણા ચૈતન્ય લક્ષ્ણાશિરોમણિ તરીકે પંકાયેલા હતા. તે પ્રલુના પ્રેમમાં અને તેની લક્ષ્ણિતમાં એટલા તો તરણોળ રહેતા કે પ્રલુનું લજન કરતાં કરતાં ઉત્કટ ભાવાવેશમાં આવી જતા. ઉચ્ચ સ્વરે હરિનામની ધૂન તે મચ્યાવતા. દરેકને લક્ષ્ણિતનો ખાધ આપતા. માધવાચાર્ય પંથના ઈશ્વરપુરી નામના એક સાધુએ તેમને દીક્ષા આપી હતી. સાધુ થઈને તેમણે પછી જાત્રાએ કરવા માંડી. જથાં જથાં જતા, ત્યાં ત્યાં તે ઉન્મત્તપણે મસ્તીથી લજન ગાતા, નાચતા, હળવો લોકોને લક્ષ્ણિતના રસથી તરણોળ કરી દેતા. લોકોને ઉપહેશ પણ આપતા. ધાર્મિક સંવાદો પણ કરતા. તેમના હૃદયના સાચા ભાવથી કંઈક લોકોનો જીવનપલટો થયો હતો. દેશહેશમાંથી પવિત્ર અને લક્ષ્ણ આત્માએ તેમની પાસે લેગા થયા હતા.

લક્ષ્ણ હરિદાસ

છેવટે શ્રીચૈતન્યદેવે જગન્નાથપુરીમાં નિવાસ કરવાનું ઠરાયું. અહીં તેમણે અને તેમના લક્ષ્ણોએ શ્રીજગનાથની લક્ષ્ણિતમાં પોતાનું જીવન બ્યતીત કરવા માંડયું. આ પવિત્ર, સાટ્ટિવિક, લક્ષ્ણમંડળ-

માં સૌથી પવિત્ર અને મધુર શ્રીહરિદાસ ઠાકુર હતા. બધા તેમને ‘ખ્રિસ્ટિયન’ ને નામે ઓળખતા. આ સાધુના જન્મ અને જીવનની બીજી હક્કીકત વિષે બહુ શ્રાદું જણાવામાં આગયું છે. એવું પણ કહેવાય છે કે, તે સુસલમાન હતા. પરંતુ એ મતને ચોક્કસ પુરાવા મળતા નથી, તેમ જ તે હક્કીકત સત્ય લાગતી નથી. શ્રીચૈતન્ય મહાપ્રભુના જીવનચરિત્ર અને એમનાં બીજાં લાખાણુમાં ઉપરોક્ત સાધુનું સ્પષ્ટ કથન થયેલું છે. તેથી એમ કહી શકાય કે તેઓ એક હરિજન હતા. પંદરમા સૈકાના છેક આંતમાં તે જન્મ પામ્યા હતા. છેક નાનપણુથી જ શ્રીકૃષ્ણભક્તિમાં તેઓ રસ ધરાવતા જણાયા હતા. એમની સાર્વિકતા, એકનિધા ને એમની પ્રેમભક્તિ વડે કરીને એમના સમકાલીન લક્ષ્યાત્મક એમણે ઉચ્ચ સ્થાન મેળગ્યું હતું. શ્રીકૃષ્ણ ચૈતન્યના લક્ષ્યાત્મકમાં તે પોતે આગળ પડતા ગણુંતા હતા.

હરિદાસની હરિભક્તિ

નાનપણુમાં હરિદાસ પોતે સૂનમૂન હેસી રહેતા. કોઈ કામમાં જીવ પરોવતા નહિ. એમને સ્વભાવ નિવૃત્તિપ્રધાન હતો. પોતાની જતની સંભાળ ક્રોણ જોઈની ઉમરના થયા, લ્યારે તે ચોતાના ગામ

ખુરાનના કેાઈ એકાંત સ્થળમાં જતા રહ્યા. અંગાળના જેસો઱ જિલ્હામાં આ ગામ આવેલું છે. તેમણે ત્યાં નાનું સરખું જૂંપડું બાંધ્યું. આગાળપાછળ અધે તુલસી વાવી. તે જગાને ઘણું રમણીય ખનાવી. પોતે તે સ્થળ ખડું જ સ્વચ્છ રાખતા. સતત હરિસ્મરણમાં પ્રત્યેક પળ પસાર કરતા. ભજનો ગાતા. ગદ્ગાદ કંઠે પ્રભુની પ્રાર્થના કરતા. તેમની અલેડ લક્ષ્મિ અને એકનિષ્ઠાથી તે આસપાસના પ્રદેશમાં જણીતા થઈ ગયા હતા. ઘણુંચે જતા—આવતા વટેમાર્ગુંઓનું તે સ્થળ આશ્રયસ્થાન ખની ચૂક્યું હતું. ઘણુાથ ગામડિયાઓના જીવનની મુરુકેલીઓ હરિદાસ પોતે ઉકેલી આપતા. તેમની મુરુકેલીમાં અને કુઃખમાં અને આપત્તિમાં તેમને તે આખાસન આપતા. ઘણુાથનાં હુદયો આમ તેમણે જીતી લીધાં હતાં. જીવનના માર્ગમાં ભૂલા પડેલાને માર્ગ ખતાવી લક્ષ્મિના સીધા રાહે તેમને વાખ્યા હતા. કેટલાચે રોગના રોગ તેમણે મરાડ્યા હતા. ભૂખ્યાંને અજ્ઞ આપતા ને તરસ્થાંને પાણી પાતા. વર્ણલેટને લીધે એમને જાઝાં કષ સહેવાં પડ્યાં નથી, એ સાચે જ ઘણું આશ્ર્યજનક છે. એમના પર શ્રીપ્રભુની અત્યંત કૃપા હતી.

અદ્વૈતાચાર્ય સાથે સંખ્ય
ત્યાર ખાદ તે શાંતિપુર પાસેના કુલિયા ગામે

ગયા. ત્યાં એક વિક્રાન વૈષણવ ખ્રાદ્ધાણુ રહેતા હતા. તે શ્રીચૈતન્ય મહાપ્રભુના મિત્ર અને અનુયાયી હતા. તેમનું નામ અદ્વૈતાચાર્ય હતું. થોડા જ સમયમાં આપણું હરિદાસને એમનો પરિચય થયો. પછી તો તેઓ એકખીજના મિત્રો હન્દ્યા. સાથે જ તે ખજે રહેવા લાગ્યા, ને સાથે જ પ્રભુભક્તિમાં પોતાના હિવસો નિર્ગમન કરવા લાગ્યા.

શ્રીમહાપ્રભુના પ્રીતિપાત્ર

થોડા સન્ય પછી હરિદાસે શ્રીકૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ વિષે સાંભળ્યું ને એમનાથી એ આકર્ષાયા. ચોતે નહિયા જઈને રહ્યા. આ મહાન દયાળું સાધુ હરિદાસની એકનિધા, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ ને ભક્તિ જોઈને શ્રીમહાપ્રભુ નવાઈ પામ્યા ને ઉત્કટ પ્રેમના આવેશમાં આવી જઈને તેઓ હરિદાસને ઝુદ્ધયથી લેઠ્યા.

પ્રભુની સેવાભક્તિમાં વર્ણ અને જતિનો લેદ રહી શકતો નથી. હરિદાસને શ્રીમહાપ્રભુએ પોતાના સ્વજન ગણ્યા ને એમના પર અત્યંત પ્રેમ રાખતા હતા. હરિદાસ શ્રીચૈતન્ય મહાપ્રભુ સાથે જ ચારાર્થે કરતા. આખરે તેમણે શ્રીમહાપ્રભુની સાથે જ પુરીમાં વસવાઈ કર્યો. ત્યાં તેઓ જુંપડામાં રહેતા. હાલ પણ એ જગાને શ્રીહરિદાસની જુંપડીની નિશાની

તરીકે યાત્રાળુંએને ખતાવવામાં આવે છે. કૃષ્ણ-
દાસના ‘ચૈતન્ય-જીવનચરિત્ર’માં હરિદાસના આગ-
મન વિષે સુંદર વર્ણન કર્યું છે. શ્રીચૈતન્ય મહા-
પ્રભુજીએ તેમનું અત્યંત ગ્રેમલક્ષ્મિપૂર્વીક સ્વાગત
કર્યું હતું. કેટલેય હરથી હરિદાસને જેતાં શ્રી-
મહાપ્રભુ ઘેલાગાંડા થઈ હોડતા હોડતા જઈ હરિ-
દાસને હૃદયથી લેટ્યા હતા. પોતાના ભક્તમંડળમાં
તેમની ભક્તિ અનેપ્રભુપરત્વેની એકનિષ્ઠાનાં વખાળુ
કરેલાં હતાં. શ્રીચૈતન્યહેવે એમના પરત્વે ખતાવેલાં
ગ્રેમ, નસ્તા, ભક્તિ વર્ગેરેનાં કેટલાંય જબ્લાંત
દિશાંતો. કૃષ્ણદાસે એમના લખેલા જીવનચરિત્રમાં
આપેલાં છે.

એમની નાચતા

જ્યારે હરિદાસ પ્રથમ શ્રીમહાપ્રભુ પાસે આવ્યા,
ત્યારે જહેર રસ્તાની એક કોરાળું દંડવતં કરીને
શ્રીમહાપ્રભુને પ્રણામ કર્યો. પોતે એ જ દર્શામાં ગાં-
ગાં કંઠે ભાવાવેશમાં આવી જઈ શ્રીપ્રભુની પ્રાર્થના
કરવા લાગ્યા :—

ખાળહઠે

(વૈદરભી વનમાં વલવલે-એ ઢાળ)

કૃષ્ણ કૃપાનિધિ ! વીનવું, હાવાં ઉર બ્યોની બાળ. કૃષ્ણું
ચરણુકમળશરણું દ્યયો, રાંક તારે હું નાથ !
આવે ન તાલ કેમે કરી ધસી મરું હું હાથ. કૃષ્ણું

તંગ ઉદ્દેશે હૈયું રહે, જેમ બોંકથાં હોય તીર;
 જ્ઞાન કરું આંસુ-નીરમાં શકું ધરી શો ધીર? હૃષ્ણુ૦
 ગ્રેમપથેથી હક્કો હતે કલયું હત ન ત્પ,
 પ્રજ્ઞાપણી આટલો જત ના રહેવો પડત ન ધૂપ. હૃષ્ણુ૦
 જ્વળન મદી શકું અનો, કરું ફરિયાદ કયાંય?
 ચેટ પાકયું હોય ત્યાંય તે બાંધું પાટો હું કયાંય? હૃષ્ણુ૦
 અટવાઈ જોઈ દીન બાળને થાએ રાજ શું આપ?
 વતંન આવું ના તમને ધટે, વધુ બળતો હું તાત. હૃષ્ણુ૦
 આપ વિના કેાની પાસથી રાખું બાળ હું આશ?
 શૈર આવતાં લાત મારશો કયાં હું ઠરું, કરો કથાસ. હૃષ્ણુ૦
 હુઃખનો માર્યો વળી ઓલું હું કદી આકરાં વેળુ,
 માહું રાખે ઉર આણુતા, દાળો અમી-ભર્યાં નોંધુ. હૃષ્ણુ૦
 બાળ-હક હાવાં હું કરું જો રીજો નવ તાત!
 ગ્રાણુ હોમી દદ્દિ હું હરિ! કરજો ફાવે ઉર વાત. હૃષ્ણુ૦

અસ્થ્યા વ્યથા

(રે શિર સાટે નટવરને વરીએ-એ ઢાળ)

રે! હરિ! હાવાં હૈયે ટાદક વાળો. (ટક)
 રે! હરિ! હાવાં હૈયે ટાદક વાળો;
 રે! વિનતિ દીનની ઉર ધારો,
 કે હરિ! હાવાં હૈયે ટાદક વાળો. રે! હરિ૦
 રે! હરિ! કરગરી કરગરી કહીએ,
 રે! વ્યથા અંતર તે કયમ સહીએ?
 કે હરિ! તમ વિણુ જો મરી મરીએ! રે! હરિ૦

ੴ! ਦਿਖਾ ਦਾਸੇਹਰ ਤੁਂ ਹਿਲ ਦਾਖੀ,
 ੳ! ਅਮੀਦਇ ਰਾਂਕਨੀ ਪਰ ਨਾਖੀ,
 ੳ! ਭਰ ਲੋ ਰਿਆਉ ਛੁਂ ਤਮ ਪਾਖੀ. ੳ! ਹਰਿ੦
 ੳ! ਨਵ ਸ਼ੈਖਵਾਚੁਂ ਤਥਾਰੈ ਜੇ ਭਾਖ-ਚੁਂ,
 ੳ! ਤਨ, ਮਨ, ਧਨ, ਵਾਰੀ ਨਾਂਖ-ਚੁਂ;
 ੳ ਤੋਥੇ ਝੁਪਾਊਤ ਨਵ ਆਖ-ਚੁਂ. ੳ! ਹਰਿ੦
 ੳ! ਹਰਿ ਵਿਣ੍ਗ ਅੰਤਰ ਨ ਲਭੀਐ,
 ੳ! ਝੁਕੈਵਾਥੇ ਨਵ, ਦਾਖੀ ਮਰੀਐ;
 ੳ ਹਰਿ! ਅਜੇ ਸ਼ਾਰਮੇ ਮਰੀ ਜਾਈਐ. ੳ! ਹਰਿ੦
 ੳ! ਦਾਮਾ ਕੁਰਜੇ ਹਰਿ ਵਣੀ ਓਲੁਂ,
 ੳ! ਨਵ ਗੁਝੈਵਾਥੇ ਤਥਾਰੈ ਹਿਲ ਓਲੁਂ;
 ੳ ਹਰਿ! ਰੋਂ ਤੁਂ ਹੁਖ ਦੁਈ ਨੇ ਤੋਲੁਂ? ੳ! ਹਰਿ੦

ਆਵੀ ਰੀਤੇ ਤੇਮਜੇ ਪ੍ਰਾਰੰਨਾ ਕੁਰਤਾ ਜਾਈ ਜੇ
 ਖੀਨ ਲਕਤੀ ਤੇਮਨੀ ਪਾਸੇ ਆਵੀ ਤੇਮਜੇ ਸ਼੍ਰੀਮਹਾਗ੍ਰਲੁ
 ਪਾਸੇ ਲਈ ਗਈ। ਪਰਿਤੁ ਹਰਿਵਾਕਸੇ ਕਲੁਂ ਕੇ, ‘ਹੁੰ ਏਕ
 ਅਤਿ ਨੀਵ ਵਣ੍ਣੀਨੇ। ਛੁਂ ਮਾਰੇ ਕੋਈ ਜਾਤਿ ਨਥੀ।
 ਮਹਿਰਮਾਂ ਪ੍ਰਵੇਸ਼ ਕਰਵਾਨੇ। ਮਜੇ ਅਧਿਕਾਰ ਨਥੀ। ਤੋ
 ਜੇ ਸਜੇ ਖਾਗਨਾ। ਕੋਈ ਏਕਾਹ ਘੂੜਾਮਾਂ ਨਾਨੀਸ਼ੀ
 ਜਗ। ਮਹਿ ਜਥ ਤੋਂ ਤਥਾਂ ਹੁੰ ਪਡ੍ਹੋ ਰਹੀਥਾ। ਏਕਾਂਤ-
 ਮਾਂ ਏਵੀ ਰੀਤੇ ਪ੍ਰੇਮਲਕਿਤਮਾਂ ਮਾਰੇ। ਸਮਥ ਵਧਤੀਤ
 ਕਰੀਥਾ। ਜਗਕਥਾਥਨਾ। ਕੋਈ ਸੇਵਕਜੇ ਮਜੇ ਅਡਕਵਾਨੇ।
 ਪ੍ਰਸਾਂਗ ਤੇਥੀ ਨਹਿ ਆਵੇ।’ ਆਟਲੁਂ ਯਾਲੀ ਹਰਿਵਾਕਸੇ
 ਤੋਂ ਹੁਕਿਨਾਮਨੀ ਧੂਨ ਮਚਾਵੀ, ਜੇ ਪੇਤੇ ਪੋਤਾਲੁਂ

લાન ભૂલી ઉનમાદમાં આવી નાચવા લાગ્યા. શ્રી ચૈતન્ય મહાપ્રબુને જેઈને તેઓ અત્યંત ભાવાવેશમાં આવી ગયા. શ્રીચૈતન્યપ્રબુ પાસે આવ્યા અને હરિદાસને પોતાની છાતી સરસા પ્રેમભાવથી ચાંચ્યા. અત્યંત પ્રેમથી હજે રહ્યા. હજે એકખીજાની પર સુંધ થયા. હરિદાસ હોલી ઉઠ્યા : ‘ અરે, પ્રબુ ! મને અડકો મા ! હું તો એક નીચ વર્ણનો અભાગી જવ છું .’

તમારા દર્શનથી પાવન થયો છું

પરંતુ શ્રીમહાપ્રબુજીએ જવાખ વાજ્યો કે, ‘ તમારા દર્શનથી તો હું પાવન થયો છું ; કારણ કે તમારા જેવી ઉત્કટ પ્રેમભાવના મારામાં નથી. તમારા જેવી એકનિષ્ઠા અને ઉત્કટ ભક્તિ જેનામાં હોય તે તો સમાજના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પણ છે. વેદાદ્યાસ, દાન, તપ, ચજ અને કઠોર તપશ્ચર્યાથી જે મેળવાય છે, તે તમારા સત્તસંગ માત્રથી મેળવાય છે. તમે તો સંન્યાસી અને પ્રાણીણ કરતાં પણ વધુ પવિત્ર છો. ’

આમ કહી હરિદાસને પોતે હાગમાં લઈ ગયા. ત્યાં એક જુહી ઓરડી આપીને કહ્યું કે, ‘ શ્રીપ્રબુના નામસમરણમાં તારું ખાકીનું લુલન આહી રહ્યી તું વ્યતીત કર. હમેશાં હું તારી પાસે આવીશ.

ભજનભાવમાં હું તારી સાથે લળીશ. અહીંયાં રહીને
હું જગત્થાથને નમન કર્યા કરી તારી ભક્તિની લેટ
શ્રીપ્રબુને ચરણુકુમળે હુમેશાં અર્પણ કરજો. પ્રત્યેક
દ્વિવસે તને શ્રીપ્રબુનો પ્રસાદ અહીંયાં જ મોંડલી
આપીશ. ’ નિત્યાનંદ, જગાનાનંદ, દામોદર, સુકુંદ
વગેરે વગેરે હરિદાસને મળી આનંદ પાસ્યા. હરિદાસ આ સંત-લક્ષ્મો સાથે પોતાનો ઘણો સમય
ભગવદ્ભાવમાં ગાળતા.

શ્રીચૈતન્યે એમનું રક્ષણ કણું

હુમેશાં શ્રીમહાપ્રબુ ગોવિંદ સાથે મહાપ્રબુનો
પ્રસાદ એમને મોંડલતા. નંદ, ચોખામેળા, રવિદાસ
વગેરે એના સમકાલીન સંતલક્ષ્મોને જીવનમાં હાડ-
મારીએ અને હુઃએ ઉચ્ચ ગણ્યાતા સમાજ તરફથી
ને વેઠવાં પહ્યાં હતાં, તે સર્વમાંથી હરિદાસ સહ-
લાઙ્ઘે મુક્ત હતા. તેમના સમકાલીન સાધુ પુરુષોમાં
એમનું માન-આદર સારું હતું. પ્રત્યેકને તે પ્રિય
થઈ પડેલા હતા. એ અધાંતું મૂળ કારણ તો
શ્રીચૈતન્ય પ્રબુ જ હતા. તેમણે હરિદાસની પ્રબુ
ઉપરની શર્દી, વિશ્વાસ, ઉત્કટ ભાવના તથા એની
ભક્તિને પિછાનીને પોતાની સાથે લીધા હતા ને
પોતાના સ્વજનોમાંના એક અનાંયા હતા. શ્રીમહા-
પ્રબુના પ્રેમમાં તો વણ્ણાવણ્ણનો લેદ ન હતો. એમનો

ગ્રેમ સર્વોધાર્યાપક હતો; તેથી તે સમયના સમાજમાંથી જાંચાનીચાપણુંનું ઝેર એછું થઈ ગયું હતું.

પૂર્વિકૃ જગન્નાથપુરીમાં ભક્તાસમાચિ.

આ સમયમાં જગન્નાથપુરી સંતલુકત અને સાધુપુરુષોનું સુખય | અને મધ્ય સ્થળ થઈ પડ્યું હતું. નંદને જેમ ચિહ્નંખરમૂ, મહારાજી ભક્તોને જેમ પંદ્રપુર, તેમ ખંગાળના સંતલુકતોને શ્રીજગન્નાથપુરી હતું. મધ્યકાલીન સમયમાં શ્રીજગન્નાથદેવનું મંદિર ખડુ વિઘ્નાતિને પામ્યું હતું. તે ધણા ધણા ફૂરના ચાત્રાળુંએને આકર્ષિતું. પ્રત્યેક વષે હજારેં યાત્રીએ ત્યાં આવતા, સમુક્રસનાન કરતા અને શ્રીજગન્નાથની પ્રાર્થના કરતા. ત્યાં ઉત્સવ—આનંદ કરતા અને ઉદ્ઘસિત હૃદયે ઘેર પાછા વળતા. તે સમયમાં વૈણવ સાધુ—ભક્તોને જગન્નાથપુરી વૈકુંઠ સમાન લાગતી. શ્રીજગન્નાથની મૂર્તિને તેએ હૃદયથી કૃષ્ણ માની એની લક્ષ્ણિતી કરતા. જગન્નાથપુરી, તેની આજુખાજુ આવેલી સુંહર જગાએં, નાની નાની પર્વતની ટેકરીએં, દરિયાકિનારે—આ ખંધાં ભક્તોના હિલમાં શ્રી-કૃષ્ણના જીવનના અનેક ગ્રસંગોની પૂર્વિક જાંખી કરાવતાં. શ્રીચૈતન્ય અને તેના અનુયાયી ભક્તો અને ખીજ સંતલુકતો પણ આહીં આવતા ને રહેતા. શ્રીજગન્નાથની સતત લક્ષ્ણિતમાં ખાકી રહેલું આચુણ્ય

ત્યાં વ્યતીત કરતા. સ્નાન, પ્રાર્થના, લજનકીર્તિન, મંહિરમાં પ્રભુનાં દર્શાન કરવા જણું, પરસ્પર હૃદયથી ભગવત્યચ્ચા પૂર્ણ ભાવથી કરવી-એવો એવો તે તે અધાંનો નિત્યકુમ હતો. ઉત્સવના એવા ખીજ પ્રસંગોએ ધાર્મિક સરવરસો અને લજનમંડળીએ નીકળતાં. લક્ષ્મી આવેશામાં આવી જઈ ઘૂણ નાચતા.

આખા શહેરમાં અધાના જમ્યા પછી તેઓ- (હિરિદાસ) પ્રભુપ્રસાદ લેતા. મંહિરના ખાડારના દરવાજે ફૂર ઊલા રહી, તેઓ પ્રાર્થના કરતાં ને આખરે એમના આવા લક્ષ્મિભય જીવનનો અંત આવ્યો. અને સને ૧૫ડાની સાલ પહેલાં તેઓશ્રી ભગવત્-જ્યોતિમાં લથ પાર્યા.

